અર્થવવેદ આધારીત

સત્પંથ યજ્ઞવિધિ

વારીયજ્ઞ મહાપૂજાના મંત્રો



પ્રકાશક

સત્પંથ પ્રકાશન સમિતિ

પ્રેરણાપીઠ-પીરાણા

અર્થવવેદ આધારીત

સત્પંથ યજ્ઞવિધિ

વારીયજ્ઞ મહાપૂજાના મંત્રો



પ્રકાશક

સત્પંથ પ્રકાશન સમિતિ

પ્રેરણાપીઠ-પીરાણા


મહાપૂજા દર્શનમ્ સતપંથ ધર્મકી, ઘટ પાટ સિંહાસન કુંભાભિષેક II
૫. કર્તા યુગે શ્રી મ.ક.વ.શ્રી નરસિંહ
સતપંથ ધર્મ ઋગ્વેદે પ્રવર્તતે
૭. ત્રેતા યુગે શ્રી વા.પ.શ્રી રામ
સતપંથ ધર્મ યજુર્વેદે પ્રવર્તતે
૯. દ્વાપર યુગે શ્રી કૃષ્ણ બુધ્ધ
સતપંથ ધર્મ સામવેદે પ્રવર્તતે
૧૨. યુગ શ્રી નિષ્કલંકી નારાયણ
સતપંથ ધર્મ અથર્વવેદે પ્રવર્તતે

અથર્વવેદ આધારીત

સત્પંથ યજ્ઞવિધિ

(વારિયજ્ઞ મહાપૂજાના મંત્રો)

॥ सनातन सत्पंथ ॥
प्रेरणापीठ-पीराणा

● પ્રકાશક ●

સત્પંથ પ્રકાશન સમિતિ

સત્પંથ પ્રેરણાપીઠ, પીરાણા

પ્રકાશક :

શ્રી સત્પંથ પ્રકાશન સમિતિ

શ્રી સત્પંથ પ્રેરણાપીઠ, પીરાણા

તા. દસક્રોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫

ફોન : (૦૨૭૧૮) ૨૮૮૮૧૨, ૨૮૮૨૨૭, ૨૮૮૨૯

દ્વિતીય આવૃતિ : ફેબ્રુઆરી ૨૦૨૦, સંવત ૨૦૭૬

મૂલ્ય : અમૂલ્ય

પ્રત : ૨૦૦૦

પ્રસ્તાવના

આપણા સત્પંથ વૈદિક ધર્મની ઘટ પાટની પૂજા યજ્ઞ વિધિ અથર્વવેદના આધારે આપણા ઈષ્ટદેવ સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે આજથી લગભગ પાંચસો પચાસ વર્ષો પહેલાં નવ પ્રતિષ્ઠિત કરીને પ્રબોધી છે. આ યજ્ઞવિધિમાં તેત્રીસ કરોડ દેવોની હાજરીમાં ૐકારના પવિત્ર ઉચ્ચારણથી દરેક મંત્રની શરૂઆત થાય છે.

ચોથો વેદ એવા અથર્વવેદના મંત્રોના વિધાન અનુસાર આ યજ્ઞ કોઈપણ વ્યક્તિ યજ્ઞના નીતિ-નિયમો અને વિવેક-મર્યાદા જાળવીને કરી શકે છે. વેદવાણી નિત્ય નવીન છે. આજના ઝડપી વિજ્ઞાન યુગમાં તે એટલી જ પ્રસ્તુત છે જેટલી પ્રાચીન કાળમાં હતી. વેદ-વાણી કદીએ જૂની થતી નથી, કારણ કે તેની વાણીમાં ત્રિકાલાબાધિત સત્યનું ઉચ્ચારણ છે.

ચાર વેદ શ્રી બ્રહ્માજીના ચારે મુખમાંથી પ્રગટ થયેલ વાણી છે. તે મનુષ્ય કૃત નથી. આથી વેદો અપૌરુષેય કહેવાયા છે. વેદો મૂળભૂત રીતે દેવ ભાષા સંસ્કૃતમાં રચાયેલા મહાગ્રંથો છે. આજના અવળા પ્રચારને કારણે, આવી દેવભાષાને ભણેલા-ગણેલા લોકો મૃત-ભાષા કહે છે. વેદોની ભાષા સમજવી આમેય કઠિન છે અને તેમાંય આ તો સંસ્કૃત ! આથી સંસ્કૃતને મૃત ભાષા માનનાર એવા આપણે, વેદોનો અભ્યાસ કરવાનું બંધ કર્યું અને વેદાભ્યાસની લાયકાત ગુમાવી. આ અવનતિનું પરિણામ એ આવ્યું કે આપણી સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરનારી આવી દેવ ભાષાને સમજવાની આપણા જનસાધારણમાં કોઈ બુદ્ધિ શક્તિ રહી નહિ.

આથી જ, અથર્વવેદ પ્રબોધિત સત્‌પંથની વારિ-યજ્ઞની વિધિનો આ ગ્રંથ સર્વ જન સમજીને આચરણ કરી શકે તેવી શુદ્ધ માતૃ-ભાષામાં પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આપણે આ મહા-પૂજા વિધિને સ્વીકારેલ છે.

વેદમાં પ્રારબ્ધવાદ અને દીનતાને સ્થાન નથી, પણ પ્રચંડ પુરુષાર્થનો ઉપદેશ છે. તેમાં દિવ્ય, તેજસ્વી જીવન-વિદ્યાનો બોધ છે. મનુષ્ય તેજસ્વી, પુરુષાર્થ ભર્યું જીવન જીવે અને ઈશ્વરના અનુગ્રહને લાયક બને એવી ઘોષણા વેદમાં છે. આથી જ યજ્ઞ-વિધિના વેદ મંત્રોમાં તેજસ્વી વાણી દ્વારા દેવોનું યજ્ઞમાં આહ્‌વાન કરવામાં આવે છે. તેત્રીસ કરોડી દેવો આ યજ્ઞમાં અદશ્યપણે હાજર રહે છે.

અનાદિ-અનંત પરિબ્રહ્મ નારાયણની પૂજા માટેની, અથર્વવેદ પ્રમાણ સિદ્ધ અને પ્રતિષ્ઠિત એવી આ ઘટ પાટની વારિયજ્ઞ પૂજા વિધિમાં વેદ મંત્રોમાં અપાર શક્તિ ભરી છે. અથર્વવેદના ત્રીજા કાંડના આઠમા સૂક્તના છઠ્ઠા મંત્ર પ્રમાણે યજ્ઞ ક્રિયામાં આપણું શુદ્ધ મન જોડી દેવાથી, આપણે યજ્ઞમાં ઈશ-શક્તિની સાથે જોડાઈએ છીએ. વેદના પ્રમાણ અને અનુભવમાં શંકાને લેશ માત્ર સ્થાન નથી. વેદમાં શંકા હોવી તે આપણા અલ્પ, શૂદ્ર, અપૂર્ણ અને અપવિત્ર મનનું કારણ છે.

લાંબા સમયથી આપણા સત્‌પંથ સમાજના આવા લઘુ (નાના) યજ્ઞ-વિધિના ગ્રંથ માટે માગણી થતી હતી. આથી આ ગ્રંથના પ્રકાશક : સત્‌પંથ પ્રકાશન સમિતિએ આ લઘુ (નાના) યજ્ઞ-વિધિનો

ગ્રંથ તૈયાર કરવાનું શરૂ કર્યું. તેમાં અથર્વવેદના મૂળ મંત્રોનું સંશોધન સાથે સંપાદન કરવામાં આવ્યું.

આ ગ્રંથ તૈયાર કરનાર અલ્પ-મતિથી ભરેલા મનુષ્યો જ છે. આથી આ ગ્રંથમાં મુદ્રણ-દોષો, અર્થ-દોષો, શબ્દ-દોષો, વિગત-દોષો રહી જવા પામ્યા હશે જ. ઘણી કાળજી રાખવા છતાં ગ્રંથમાં ક્યાંક પણ કોઈ પણ પ્રકારની ક્ષતિઓ જણાય તો વિશાળ મનનો સત્‌પંથ સમાજ ઉદાર ભાવે તે ક્ષમા કરશે જ એવી અપેક્ષા છે. વાંચનાર, આ ગ્રંથની ક્ષતિઓ તરફ ધ્યાન દોરશે તો, તેની બીજી આવૃત્તિ પ્રસંગે તે અતિ ઉપયોગી થઈ પડશે.

અંતમાં સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ એવં ઈષ્ટદેવ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી સર્વને સદ્‌બુદ્ધિ આપો અને વેદ ધર્મનો નવ-ખંડમાં જયજયકાર હો એજ અભ્યર્થના.

: પ્રકાશક :

શ્રી સત્‌પંથ પ્રકાશન સમિતિ
પ્રેરણા પીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-૩૮૨૪૨૫.

ગુરુવંદના (પ્રાર્થના)

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ, ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુર્વે નમઃ ।।

ધ્યાન મૂલમ્ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ્ ગુરુર્પદમ્ ।
મંત્ર મૂલમ્ ગુરુર્વાક્યં, મોક્ષ મૂલમ્ ગુરુર્કૃપા ।।

પદવંદન કરું ગુરુદેવનું, જે સકળ ગુણ ચતુર સુજાણ,
પૂર્ણ બ્રહ્મ દ્રષ્ટે કરી, અચળ પુરુષ પુરાણ.
પૂજન કરું ગુરુપદનું, જેથી ચૌદે લોક પૂજાય,
શેષ બ્રહ્મા શક્તિ મળી, ગુણ ગુરુજીના ગાય.
કૃપા હોય જો ગુરુદેવની, તો ટળે ચોર્યાશીના તાપ,
જન્મ મરણની આપદા, છૂટે આપો આપ.

ॐ

ऋतस्यर्तेनादित्या यजत्रा मुञ्चतेह नः ।

यज्ञं यद्यज्ञवाहसः शिक्षन्तो नोपशेकिम ॥२॥

अथर्ववेद : कांड-६, सूक्त-११४, मंत्र-२.

॥ મુખી મહારાજે ક્ષમા માગવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ક્ષમા હજાર વાર ॥ સેવક અપરાધી ॥ કીધા અનંત અપરાધ ॥ આદ્ય અંતના ધણી શ્રી

નિષ્કલંકી નારાયણ ।। તમે જાંબુદ્વીપના ધણી ।। વિષ્ણુ નારાયણ વિશ્વાધાર ।। સૃષ્ટિના સર્જનહાર ।। જાંબુદ્વીપે ધર્યો અવતાર ।। રેણી કીજે ખેર ।। દિવસ કીજે મહેર ।। સ્નેહની દૃષ્ટિ કરો ।। સેવકનાં દુઃખ-દરિદ્ર દૂર કરો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●



ॐ

यज्ञस्य चक्षुः प्रभृतिर्मुखं च वाचा श्रोत्रेण मनसा जुहोमि ।
इमं यज्ञं विततं विश्वकर्मणा देवा यन्तु सुमनस्यमानाः ॥५॥

अथर्ववेद : कांड-२, सूक्त-३५, मंत्र-५.

॥ મુખી મહારાજે આસન આગળ ઊભા રહીને સ્તુતિ કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ શબ્દ તો ૐ કાર ॥ ૐકારથી ધૂંધૂકાર ॥ નિરંજન નિરાકાર ॥ તમે સૃષ્ટિના સર્જનહાર ॥ સ્વામી ! તમે ધર્યા અવતાર ॥ સ્વામી ! ધર્મ માંહે તમે ॥ સ્વામી ! સૃષ્ટિ માંહે તમે ॥ પ્રગટ

તમે, પ્રત્યક્ષ તમે, કાયમ તમે ॥ નિત્ય તમે, આદ્ય તમે, અંત તમે ॥ કળા તમારી, અસ્તિત્વ તમારું ॥ ભાવ, ભક્તિ, શ્રદ્ધા અમારાં ॥૫॥ અમો સેવક અપરાધી ॥ સ્વામી ! તમો અપરાધ ક્ષમા કરનાર ॥ સેવકોને દર્શન દેજો ॥ ફળંતર વેળામાં ઉગારી લેજો ॥ આસને સિંહાસને આવી પરવરો ॥ કીધા અપરાધ ક્ષમા કરો ॥ બીજા અપરાધ ન કરાવશો ॥ પાંચ, સાત, નવ, બાર, તેત્રીસ કરોડીના મેળા આપો ॥ લાખ ચોર્યાસીના ફેરા ટાળો ॥ ગત્ગંગાને દર્શન દેજો ॥ સ્વામી ઐક્ય કરો ॥ દ્વૈત દૂર કરો ॥ ધર્મ સ્થાપો ॥ પાપ કાપો ॥ સતિયાંની સોબતમાં રાખો ॥ સામર્યા સહાય કરો ॥ કરગર્યા કાને ધરો ॥ આવાગમન દૂર કરો ॥

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●

ॐ

प्रवतो नपान्नम एवास्तु तुभ्यं नमस्ते हेतये तपुषे च कृण्मः ।
विद्म ते धाम परमं गुहा यत्समुद्रे अन्तर्निहितासि नाभिः ॥३॥

अथर्ववेद : कांड-१, सूक्त-१३, मंत्र-३.

॥ મુખી મહારાજે પ્રથમ જમણો પગ આસન ઉપર મૂકી, પ્રાર્થના કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

હે જંદા ।। કાયમ દેવ પાયા ।। સ્વામી પાયા ।। સ્વામીજીનાં દર્શન પાયા ।। ઋષિવરોનાં રાજ પાયા ।। અમરાપુરના વાસ પાયા ।। અનંત કરોડીના સત્સંગ પાયા ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

महीमू षु मातरं सुव्रतानामृतस्य पत्नीमवसे हवामहे ।
तुविक्षत्रामजरन्तीमुरूचीं सुशर्माणमदितिं सुप्रणीतिम् ॥२॥

अथर्व वेद : कांड-७, सूक्त-६, मंत्र-२.

॥ ઘટના આસનનો પાટ માંડવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી તમે ૐ કાર માંહે આપો આપ ॥ શક્તિ રૂપી જપાવ્યો જાપ ॥ શક્તિ રૂપી રચ્યો સંસાર ॥ શક્તિ વેદ ઉત્તમ આચાર ॥ હેઠે શક્તિને ઉપર કલા ॥ પાંચ દેવ તે સભરે ભર્યા ॥ આસન શક્તિ નૂરી તેજ ॥ નૂરે સર્જ્યા નિરંજન હેત ॥ શ્રેષ્ઠ શક્તિ માટી સહી ॥ માટી વિના ન ઉપન્યા કોઈ ॥ માટી ઘટ ને માટી પાટ ॥ માટી મોક્ષ મુક્તિની વાટ ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●



ॐ

वाजस्य नु प्रसवे मातरं महीमदितिं नाम वचसा करामहे ।
यस्या उपस्थ उर्वं१न्तरिक्षं सा नः शर्म त्रिवरूथं नि यच्छात् ॥२॥

अथर्ववेद : कांड-७, सूक्त-७, मंत्र-२.

॥ પાટ માંડી નમસ્કાર કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! તમારા દશે અવતારોને પ્રણામ ॥ પૃથ્વી માતા તમને પ્રણામ ॥ માતા વસુંધરા તમને પ્રણામ ॥ સ્વામી ! અલખ તમે ॥ અમર તમે ॥ કાયમ તમે ॥ કિરતાર તમે ॥ દર્શન દેજો તમે ॥ માતા વસુંધરા ! તમને પ્રણામ ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●

ॐ

ब्रह्मास्य शीर्षं बृहदस्य पृष्ठं वामदेव्यमुदरमोनदस्य ।

छन्दांसि पक्षौ मुखमस्य सत्यं विष्टारी जातस्तपसोऽधि यज्ञः ॥१॥

अथर्व वेद : कांड-४, सूक्त-३४, मंत्र-१.

॥ પાટ ઉપર અક્ષત મૂકવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ આદ્ય નિરંજન ધૂંધૂકાર ॥ સૃષ્ટિ કાજે ગોર-નરે ધર્યા અવતાર ॥ ધૂંધૂકારમાં ધ્યાન જ ધરી ॥ છત્રીસ યુગને ચોર્યાસી ચોકડી પહેલી કરી ॥ પહેલાં સજ્ર્યા બ્રહ્મા તન ॥ તેથી સજ્ર્યા આત્મ રતન ॥ આપસ તનથી પ્રગટ્યા નૂર ॥ તેના સજ્ર્યા ચંદ્ર-સૂર્ય ॥ નારાયણે સર્જી મૂરત ચાર ॥ ચતુર્વેદને ૐ કાર ॥ ૐ કારથી સજ્ર્યા સત્‌પંથ ॥ ધરી અવતારને બાંધ્યા બંધ ॥

સ્વામી ! અથર્વવેદને ચોક સિંહાસને આવો ॥ ઘટમાં આવીને વાસ કરો ॥ પાટની પૂજાએ રહો ॥ કળશ માંહે કળા ધરો ॥ ઘટ-ઘટમાં આવી પરવરો ॥ આદ્ય બ્રહ્માએ ઘટ પાટ સ્થાપ્યા ॥ ચતુર્દિશામાં ફેરવી દુહાઈ ॥ અનંત રૂપે ચરિત્ર કીધાં ॥ કર્તા મૂરત સોહી ॥ આલોક, પરલોક, દેવલોક, ગત્‌ગંગા તથા આજ્ઞાંકિત સેવકોનાં આમંત્રણ સ્વીકારો ॥ કળશ માંહે તમારી કળા ધરો ॥

નિરંજન નિષ્કલંકી નારાયણ ।। સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહે દર્શન દીધાં ।। બાર કરોડી જીવો ઉદ્ધાર્યા ।। સદ્‌ગુરુએ બતાવ્યા ધર્મ ને જપાવ્યા જાપ ।। સદ્‌ગુરુએ કીધા પાક ।। ગોરનરે પૂરી શાખ ।। મુખી મહારાજ સ્થાપ્યા સવા લાખ ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

इन्द्रो मा मरुत्वान् प्राच्या दिशः
पातु बाहुच्युता पृथिवी द्यामिवोपरि ।
लोककृतः पथिकृतो यजामहे ये
देवानां हुतभागा इह स्थ ॥२५॥

अथर्व वेद : कांड-१८, सूक्त-३, मंत्र-२५.

॥ પાટને ચારે દિશાએ પૈસા મૂકવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! આજ કલિયુગનું વર્તમાન ।। જો આજ નારાયણનું સ્થાન ।। ઘટે બ્રહ્મા ।। ઘટે વિષ્ણુ ।। ઘટે દેવ મહેશ્વર ।। ઘટમાં ચૌદ લોકનો વાસ ।। તેત્રીસ કરોડી દેવતાનો વાસ ।। ઘટ મધ્યે બ્રહ્મા-વિષ્ણુનો પરિવાર ।। જે આજ કલિયુગમાં હોય તેનો વાસ ।। પાત્ર નિષ્કલંકી નારાયણ ।। સિંહાસન તમારું ।। તમે સ્થાપો ।। તમે બેસો ।। સત્ તમારું ।। દત્ત તમારું ।। ધર્મ તમારો ।। કર્મ અમારું ।। ભાવ ભક્તિ શ્રદ્ધા અમારાં ।। અમે સેવકો અપરાધી ।। અમને તમારા ચરણમાં રાખો ।।૭।। સમર્યા સહાય કરો ।। કરગર્યા કાન ધરો ।। આવાગમન દૂર કરો ।।૮।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

भग एव भगवाँ अस्तु देवस्तना वयं भगवन्तः स्याम ।
तं त्वा भग सर्व इज्जोहवीमि स नो भग पुरएता भवेह ॥ ५ ॥

अथर्व वेद : कांड-३, सूक्त-१६, मंत्र-५.

॥ પાટે પૈસા મૂકી પગે લાગવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ આદ્ય નારાયણે કીધો વિસ્તાર ॥ ત્યારે દિશા આલેખી ચાર ॥ ચતુર્દિશામાં કીધાં ચતુર્થ

મુકામ ।। ત્યાં સદ્ગુરુએ દેખાડ્યાં હરિનાં ધામ ।। પ્રથમ, દ્વિતીય, તૃતિય, ચતુર્થ કલ્પની શાખ ધરી ।। સદ્ગુરુએ નામ ભણાવ્યાં હરિ ।। ઝાંખા , મેઘા , કિન્નર અનંત ।। જેણે સદ્ગોરશું રાખ્યાં અવિચળ ચિત્ત ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।।ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

यस्य कृण्मो हविर्गृहे तमग्ने वर्धया त्वम् ।

तस्मै सोमो अधि ब्रवदयं च ब्रह्मणस्पतिः ।।३।।

अथर्व वेद : कांड-६, सूक्त-५, मंत्र-३ .

॥ કળશને ધૂપ-લોબાનથી પવિત્ર કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ધૂપ જલે ॥ અગર જલે ॥ ભવની પીડા ટળે ॥ દેવ જાગે ॥ ત્યાં દૈત્ય ભાગે ॥ ધૂપ ત્યાં રૂપ ॥ દેવ

ત્યાં પૂજા ॥ અલખ નિરંજન નિરાકાર ॥ અવર દેવ નહિ દૂજા ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●



ॐ

अप तस्य हतं तमो, व्यावृतः स पाप्मना ।
सर्वाणि तस्मिन ज्योतींषि, यानि त्रीणि प्रजापतौ ॥४०॥

अथर्व वेद : कांड - १०, सूक्त - ७, मंत्र - ४०.

॥ દિવ્ય જ્યોતને પ્રણામ કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ગુરુ દીવો ॥ ગુરુ દેવતા ॥ ગુરુ વિના ઘોર અંધકાર ॥ ગુરુ વિના યુક્તિ નહિ ॥ ગુરુ વિના

મુક્તિ નહિ ।। મન તાળું ।। ગુરુમંત્ર કુંચી ।। ખોલો ધર્મ દ્વાર ।। દેખો નારાયણકા દિદાર ।। તરીએ ભવ-સાગર પાર ।। જાગે જ્યોત, ત્યાં ભાગે છોત ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ૐ



दिव्यं सुपर्णं पयसं बृहन्तमपां गर्भं वृषभमोषधीनाम् ।
अभीपतो वृष्ट्या तर्पयन्तमा नो गोष्ठे रयिष्ठां स्थापयाति ॥१॥

अथर्व वेद : कांड-७, सूक्त-३९, मंत्र-१.

॥ કળશમાં જળ ભરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ૐ ઉનાદ , સાદ , શબ્દ , નૂર, તેજ, બિંબ ॥ આપોઆપ ઉપાયા ઇંડ ॥ ઇંડ માંહેથી સર્જ્યાં પિંડ ॥ પિંડ માંહે ઈચ્છા કીધી ॥ અનંત લીલા વર્તી લીધી ॥ ઇંડ છેદીને ઉપન્યા આપ ॥ ચતુર મૂરતની કીધી સ્થાપ ॥ કહી આદેશને ઓમકાર ॥ પ્રગટ

કીધી મૂરત ચાર ।। ખાણી, વાણી ને સર્જ્યાં વેદ ।। જુજવા વારાને જુજવા ભેદ ।। હરિઅંશમાં છે ભરપૂર ।। સ્થળ બાંધી સર્જ્યાં નૂર ।। નૂર કાંડી અજંપા જાપ ।। ચતુર મૂરત તે નિરંજનદેવ આપ ।। અનંત દેવને ઉપન્યા બ્રહ્મ ।। આદ્ય બ્રહ્માએ સ્થાપ્યા ધર્મ ।।

સ્વામી પુરુષને શક્તિ સાર ।। વિષ્ણુ જળને કળશ કિરતાર ।। આશ પૂરો ।। વાસ કરો ।। નૂરનો પ્રકાશ કરો ।। કળશ માંહે કળા ધરો ।। ઋષિવર જીવોને પાવન કરો ।। સદ્ગોર ઈમામશાહ મહારાજ અરજ કરે ।। જાંબદ્વીપે કુંવારિકા ક્ષેત્રે ।। શ્રી નિષ્કલંકી નારાયણ રૂપે ।। કળશ માંહે કળા ધરો ।। ઘટ માંહે વાસ તમારો કરો ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ૐ

पृतनाजितं सहमानमग्निमुक्थैर्हवामहे परमात्सधस्थात् ।

स नः पर्षदति दुर्गाणि विश्वा क्षामद्देवोऽति दुरितान्यग्निः ॥१॥

अथर्व वेद : कांड - ७, सूक्त-६३, मंत्र-१.

॥ કળશ સ્થાપીને પગે લાગવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

વિષ્ણુ ઉપજંતે મહા વેહવા રંગ ।। શક્તિ ઉપજંતે અનંત તત્ત્વમ્ ।। સ્વામીજી ! તમારું સિંહાસન સ્થાપો ।। તમે નૂરે પરવરો ।। ઘટમાંહે વાસ તમારો કરો ।। તમે અનંત વાર સ્થાપો ।। તમે અનંત વાર ઓચરો ।। તમે અથર્વવેદને વાયકે ફળો ।।

તમે આદ્ય નારાયણ કળા પ્રકાશીને ।। ત્રણે દેવ પેદા કીધા ।। તે દેવ યુગે યુગે આવી અવતર્યા ।। ઘટે બ્રહ્મા ।। ઘટે વિષ્ણુ ।। ઘટે દેવ મહેશ્વર ।। અથર્વવેદની કળા ધરો ।। ઘટમાં ઈશ્વર ।। તમે કર્તા ।। તમે હરતા ।। આદ્ય બ્રહ્માએ ઘટ-પાટ સ્થાપી ।। ચતુર્દિશામાં ફેરવી દુહાઈ ।। અનંત રૂપે ચરિત્ર કીધાં ।। કર્તા મૂરત સોહી ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

विष्णोर्नु कं प्रा वोचं वीर्याऽणि यः पार्थिवानि विममे रजांसि ।

यो अस्कभायदुत्तरं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायः ॥१॥

अथर्व वेद : कांड-७, सुक्त-२६, मंत्र-१.

॥ કળશ ઉપર અક્ષત તારવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ આદ્ય નિરંજન ૐ કાર ॥ ૐ કારથી ધૂંધૂકાર ॥ સૃષ્ટિ તણો કીધો વિસ્તાર ॥ સ્વામી ! તમે

ધર્યા અવતાર ॥ મનમાંહે હરિએ ધર્યાં હેત ॥ ત્યારે રચ્યું એક બ્રહ્મ જ ક્ષેત્ર ॥ બ્રહ્મા તનથી ઝર્યા નૂર ॥ ત્યારે સજર્યા આત્મ રતન ભરપૂર ॥ હરિએ કીધાં દષ્ટે કામ ॥ ત્યારે સજર્યા પિંડને પ્રાણ ॥ પિંડ માંહે મૂકી માયા ॥ અનંત સ્વરૂપી સરજી કાયા ॥

જળ અક્ષતે પૂરો વાસ ॥ આદ્ય નિરંજન માંહે પ્રકાશ ॥ કળશે ચાર મૂરત મળી કરો જુક્તિ ॥ ઋષિવર જીવોને આપો મુક્તિ ॥ જાંબુદ્વીપે ભરત ખંડે કુંવારિકા ક્ષેત્ર સ્થાને બેસો ॥ તમે નિરંજન નિષ્કલંકી નારાયણ ॥ સદ્ગોર આદ્ય બ્રહ્મા ॥ તમે અક્ષત રૂપે કળશ માંહે કળા ધરો ॥ ઘટ માંહે તમારો વાસ કરો ॥

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

ऋतस्य पन्थामनु तिस्त्र आगुस्त्रयो धर्मा अनु रेत आगुः ।
प्रजामेका जिन्वत्यूर्जमेका राष्ट्रमेका रक्षति देवयूनाम् ॥१३॥

अथर्व वेद : कांड-८, सुक्त-९, मंत्र-१३.

॥ કળશ ઉપર અક્ષત તારીને પગે લાગવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! અક્ષત બ્રહ્મ સ્વરૂપે તમે છો ॥ ઘટ-પાટના ધણી તમે છો ॥ ઘટ માંહે વાસ તમારો ॥ સ્વામી દાતા - ભોક્તા તમે છો ॥ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદ્ય નારાયણ, આદ્ય શક્તિ રૂપે ॥ ઘટ માંહે વાસ પૂરો ॥ આદ્ય અંતના ધણી તમે છો ॥ અથર્વવેદની કળા ધરો ॥ તમે પ્રગટ રૂપ ધરો જાંબુદ્વીપના ધણી ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

प्रपथे पथामजनिष्ट पूषा प्रपथे दिवः प्रपथे पृथिव्याः ।
उभे अभि प्रियतमे सधस्थे आ च परा च चरति प्रजानन् ॥१॥

अथर्व वेद : कांड-७, सुक्त - १ , मंत्र-१.

॥ ઘટ-પાટને ફૂલહાર ચડાવવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! પાન ફૂલના ભોક્તા તમે છો ॥ સ્વામી ! પાન-ફૂલનો સ્વીકાર કરો ॥ સ્વામી ! તમે પાન-ફૂલમાં વાસ કરો ॥ સ્વામી ! તમારા નામ પર બલિહારી જાઉં ॥ સ્વામી ! તમો પરમ પવિત્ર ॥ સ્વામી ! તમો

ભાગ્ય વિધાતા ।। સ્વામી ! તમો ઈષ્ટ ।। સ્વામી ! તમો રક્ષક ।। સ્વામી ! તમો સૃષ્ટિના સર્જનહાર ।। સ્વામી ! તમો આદ્ય ।। સ્વામી ! તમો અંત ।। સ્વામી ! તમો અવતાર ।। સ્વામી ! તમો પાત્ર ।। સ્વામી ! તમો શ્રી મત્સ્ય, શ્રી કૂર્મ, શ્રી વરાહ, શ્રી નરસિંહ, શ્રી વામન, શ્રી પરશુરામ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ ।। સ્વામી ! તમો શ્રી નિષ્કલંકી નારાયણ ।।

સૌને દેજો દર્શન ।। સદ્‌ગોર પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ મહારાજ ।। તમારા નામ પર બલિહારી જાઉં ।। અનંત અવગુણ અમારા ।। અમો સેવક અપરાધી ।। તમો સાહેબ ક્ષમા બક્ષણહાર ।। જાંબુદ્વીપે કુંવારીકા ક્ષેત્રમાં ।। ઋષિવર જીવોને આપો દર્શન ।। સ્વામી ! કૃપા કરો ।। કળશ માંહે કળા ધરો ।। સ્વામી ! નૂર સ્વરૂપે ફૂલવાસ માંહે પરવરો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

पूषेमा आशा अनु वेद सर्वाः सो अस्माँ अभयतमेन नेषत् ।

स्वस्तिदा आघृणिः सर्ववीरोऽप्रयुच्छन्पुर एतु प्रजानन् ॥२॥

अथर्व वेद : कांड-७, सुक्त-९, मंत्र-२.

॥ ઘટ-પાટને ચૂવા-ચંદન, અબીલથી પૂજન કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! કેસર-કસ્તૂરીના ભોક્તા તમે છો ।। સ્વામી ! અગર-ચંદનના ભોક્તા તમે છો ।। સ્વામી ! અત્તર, અબીલ-ગુલાલના ભોક્તા તમે છો ।। સ્વામી ! પરિમલ વાસનાના ભોક્તા તમે છો ।। સ્વામી ! દાતા ભોક્તા તમે છો ।। સ્વામી ! ચૂવા-ચંદન, કેસર-કસ્તૂરી, અત્તર, અબીલ, ગુલાલની વાસનાનો તમે સ્વીકાર કરો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात ॥

ऋग्वेद-मंडळ-३२, सूक्त-६२, मंत्र-१०.

॥ હરિઅંશ વૃક્ષ-ગાયત્રી મંત્ર ॥

આદેશ = હરિ ॐ

ॐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ॐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ પરમેશ્વરા ॥ પ્રવાદે જલ સાગરા ॥ સેવાને કારણે હેત રચંતે ॥ ધરતી ઉપર પાએ ન દેતવા ॥ સદા સર્વ પ્રલયે ગતમ્ ॥ પ્રથમ નીલ વર્ણ તે ધૂંધૂકાર ॥ ત્યારે સ્વામી તમે આદ્ય નિરંજન નિરાકાર ॥ ત્યાં કવન ચેન પરિવર્તન્તે ? દિવ્ય દેહી તે આદ્ય પુરુષ નારાયણ ॥ આપ

મને આપ ધ્યાન કર્તવ્યમ્ હો સ્વામીજી ॥

તદા નૂર નિર્વાણ આપ હસ્તકે ॥ તદા નિરંજન તે નિરાકાર ॥ ત્યાં નીલ વર્ણ તે ધૂંધૂકાર ॥ ત્યારે નહિ સાદ ॥ નહિ શબ્દ ॥ નહિ ઉનાદ ॥ નહિ ૐ કાર ॥ નહિ ઉત્પત્ત ॥ નહિ રેવત ॥ નહિ રચના ॥ નહિ પવન ॥ નહિ પાણી ॥ નહિ ખાણી ॥ નહિ વાણી ॥ નહિ વેદ ॥ નહિ ભેદ ॥ નહિ જળ ॥ નહિ કમળ ॥ નહિ હમળ ॥ નહિ વમળ ॥ નહિ પર્વત ॥ નહિ પાષાણ ॥ નહિ નદીઓ ॥ નહિ નવાણ ॥ નહિ સમુદ્ર ॥ નહિ સાગર ॥ નહિ ગિરિવર ॥ નહિ કૈલાસ ॥ નહિ મેરુ ॥ નહિ મેખલા ॥ નહિ સ્વર્ગ ॥ નહિ નરક ॥ નહિ મૃત્યુ ॥ નહિ પાતાળ ॥ નહિ ધરતી ॥ નહિ આકાશ ॥ નહિ ચંદ્ર ॥ નહિ સૂર્ય ॥ નહિ તારા ॥ નહિ ધ્રુવ ॥ નહિ મેઘ ॥ નહિ મંડળ ॥ નહિ રેણી ॥ નહિ દિવસ ॥ નહિ સૂન ॥ નહિ પોકાર ॥ નહિ જરણ ॥ નહિ મરણ ॥ નહિ સૃષ્ટિ ॥ નહિ સંયોગ ॥ નહિ ભાવ ॥ નહિ ભયંકાર ॥ નહિ રૂપ ॥ નહિ રેખા ॥ નહિ રાગ ॥ નહિ ભાષા ॥ નહિ દમ ॥ નહિ કદમ ॥ નહિ રીત ॥ નહિ કરીત ॥ નહિ યોગ ॥ નહિ યુક્તિ ॥

નહિ શક્તિ ॥ નહિ ભક્તિ ॥ નહિ મોહ ॥ નહિ માયા ॥ નહિ કામ ॥ નહિ કાયા ॥ ત્યારે ભાવ ભેદ કંઈ નહોતા ॥

તદા આદ્ય નિરંજને કઈ પેરે સૃષ્ટિ નિપાઈ, હો સ્વામીજી ॥ પ્રથમ નીલ વર્ણ ધૂંધૂકાર ॥ ધૂંધૂકાર મધ્યે ૐ કાર ॥ ૐ કારથી હેત ધરીઆ ॥ હેત થકી નીર ઝરીયા ॥ નીર થકી ખીર કરીયા ॥ ખીર થકી ફીણ ઉપાયા ॥ ફીણ માંહેથી ઈંડ નિપાયા ॥ ઈંડ થકી રચંતે સર્વ રચના ॥ ઈંડ છેદીને ત્રણ ભુવન સર્જ્યા, હો સ્વામીજી ॥

પ્રથમ પાંચ યુગ તો જમીનની જડ બાંધંતાં ॥ પાંચ યુગ તો પિયાલ થોભંતાં ॥ પાંચ યુગ તો ગઢ મેરુ ઉઠંતાં ॥ પાંચ યુગ તો બ્રહ્માંડ જડંતાં ॥ આઠ યુગ તો ગીતા-ગાયત્રી ઓચરંતાં ॥ નવ યુગ તો નીર નવાણ ભરંતાં ॥ બાર યુગ તો રૂઢ માળા ફેરવંતાં ॥ વીસ યુગ તો વિભુ વનસ્પતિ વસંતાં ॥ ત્રણ યુગ તો ત્રિભુવન ત્રિશૂળ ધરંતાં ॥ એક યુગ તો ૐ કાર બોલી ભણંતાં ॥ એવા તોંતેર યુગ તો વહી ગયા સ્વામીજીને અટકળ કરંતાં ॥

તદા અગમ અગોચર સદ્‌ગોર બ્રહ્મા ।। નર નારાયણ ।। દેવ મહેશ્વર ।। એ ત્રણ દેવની જે પૂજા કરે ।। તેના આવાગમનના ફેરા ટળે ।।

તદા સ્વામીજીએ પહેલા રોપ્યા સત્ય ।। સત્ય ઉપર દત્ત ।। દત્ત ઉપર ક્ષમા ।। ક્ષમા ઉપર ગજા ।। ગજા ઉપર નીલ ।। નીલ ઉપર શેષનાગ ।। શેષનાગના શિર ઉપર ધબલા ધોરી ।। ધબલા ધોરીના શીંગ ઉપર એક રાઈ ।। એટલા ઉપર યત્ન કરી સ્વામીજીએ સૃષ્ટિ નીપાઈ ।। જે કરણ કલ્પના અવતાર પાત્ર સાંભળો ઋષિવર ભાઈ ।। જ્યાં થકી સ્વામીજીએ રૂપ ધર્યા ।। તે રૂપ ઓળખીને આજ કરો કમાઈ ।।

પ્રથમ નામ તો નીલ ।। અનીલ ।। સૂન ।। શાન ।। નાન ।। જ્ઞાન ।। મેયાન ।। નૂર ।। તેજ ।। જળ ।। કમળ ।। કદમ ।। આદ બુંદ ।। નાદ બુંદ ।। ગજ તત્ત્વ ।। પ્રેમ તત્ત્વ ।। આદ્ય પુરુષ ।। આદ્ય પુરુષથી ૐ કાર ।। ૐ કારથી ચારે વેદ પ્રકાશ ।। આદ્ય પુરુષથી નાભિ ચક્ર ।। નાભિ ચક્રથી ભયે સદ્‌ગોર બ્રહ્મા ।। સદ્‌ગોર બ્રહ્માથી સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ ।। જે ચાર કલ્પના અવતાર

પાત્ર સાંભળો ઋષિવર ભાઈ ॥ જ્યાં થકી ગોર નરે અવતાર લીધા, તે અવતાર ઓળખીને આજ કરો કમાઈ ॥

પ્રથમ નામ તો ૐ કાર ॥ ઉનાદ ॥ અવિગત્ય ॥ અહેદ ॥ હવ ॥ કવ ॥ તત્ત્વ ॥ ધર્મ ॥ તેજ ॥ કેવલિક ॥ નાદ ॥ ઓત્રા ॥ હરિતખ્ત ॥ પુરૂરવા ॥ અતીતવંશી ॥ પ્રેમ ઋષિ ॥ અંશ તો શ્રી મત્સ્ય ભગવાન ॥૧॥ શ્રી મત્સ્ય ભગવાનના મનાઈત ॥ ઉગ્રસેન ॥ અજુવંત ॥ બ્રેહસ્પત ॥ અશોમિત્ર ॥ પ્રિકમ ઋષિ ॥ અંશ તો શ્રી કૂર્મ ભગવાન ॥૨॥ શ્રી કૂર્મ ભગવાનના વસરત ॥ દકાઈત ॥ કાત્યાયન ॥ પરજાઈત ॥ દાઢમ ઋષિ ॥ અંશ તો શ્રી વરાહ ભગવાન ॥૩॥ શ્રી વરાહ ભગવાનના દેહેર ॥ રૂપક ॥ કેશવ ॥ નસખલિપત્ય ॥ ગૌતમ ॥ અંબરિષ ॥ અંશ તો શ્રી નૃસિંહ ભગવાન ॥૪॥ શ્રી નૃસિંહ ભગવાનના મુનાયક ॥ વંશ વઢણ ॥ વીર લોચન ॥ કશ્યપ ઋષિ ॥ અંશ તો શ્રી વામન ભગવાન ॥૫॥ શ્રી વામન ભગવાનના માનધાતા ॥ પૃથ્વીજય ॥ અસરત ॥ જમદગ્નિ ઋષિ ॥ અંશ તો શ્રી પરશુરામ ભગવાન ॥૬॥ શ્રી પરશુરામ ભગવાનના

રઘુ ।। નઘુ ।। યયાતિ ।। કેવલિક ।। અજેપાલ ।। દશરથ ।। અંશ તો શ્રી રામ ભગવાન ।।૭।। શ્રી રામ ભગવાનના લવ ।। પદ્મ ।। પરીક્ષિત ।। વીરપાલ ।। વસુદેવ ।। અંશ તો શ્રી કૃષ્ણ ભગવાન ।।૮।। શ્રી કૃષ્ણ ભગવાનના પ્રદ્યુમ્ન ।। સેસ્થાન ।। બિલસ્થાન ।। વેણી વત્સરાજ ।। સિંહરાજ ।। અંશ તો શ્રી બુદ્ધ ભગવાન ।।૯।।

શ્રી બુદ્ધ ભગવાનથી જે હરિઅંશ આજ કલિયુગમાં ગુપ્ત ચાલ્યો આવે છે, તે જ હરિઅંશમાં કલિયુગને અંતે ધર્મની સ્થાપનાને માટે ।। આદ્ય વિષ્ણુ ભગવાનનો જે અંતિમ દસમો અવતાર પ્રગટ થશે ।। તે આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણને ગત્‌ગંગાના કોટિ કોટિ નમસ્કાર ।।

卐 અથર્વવેદી ગાયત્રી મંત્ર છે 卐

આદેશ = હરિ ૐ

ૐ ૐ ૐ કારમ્ ।। કલ્યંગકર્તા ।। વિશતિવિશ્વાપાપમ્ ।। વિશ્વા ધર્મઃ ।। અરૂદ્ધં પાતકમ્ ।। ધર્મોરેખા માત્રાઃ ।। ધર્મ ઈતિ પરિબ્રહ્મઃ ।। અથર્વવેદઃ શ્વેતવર્ણઃ ।। વર્ણાદિવિષ્ણુઃ ।। સવિષ્ણુ નારાયણઃ ।। બ્રહ્માંઝંમ્ ।। બ્રહ્મઅંશાદિઃ પાત્રઃ ।। વર્ણાદિ

ધર્મોમ્લેચોઅભૂજ્જગતિ॥ ઈચ્છાંગો વિષ્ણુનારાયણઃ ॥ અતઃ પરિવક્ષ્યામિ મહાજ્ઞાનભેદમ્ ॥ જાંબુદ્વીપે કલાંગમ્ પવિત્રંવર્તમાનમ્॥ મહાકલિયુગ ઉપજાયતે નારાયણઃ॥ તેજોભવિતા અંગકર્તા ॥ પ્રજવાલયતિ પાતકમ્ ॥ અનાદિ પુરુષઃ ॥ મમ જીવનં ભવતિ ॥ આર્યાગમ્ પરિબ્રહ્મઃ ॥ ષોડશકલાગમ્ મંગલશ્ચ સત્ત્વાનિ ॥ સત્યાત્રાદિ પરમેશ્વરઃ પરિબ્રહ્મઃ ॥ અનાદિ પુરુષ વેલાગમ્ ભવતિ ॥ કર્માયિતિ પરિબ્રહ્મઃ ॥ સ્થલે સેવાગમ્ નમઃ ॥ સર્વ ઈતિ પરિબ્રહ્મઃ ॥ પરમેશ્વરઃ પરિબ્રહ્મઃ ॥ ૐ શાન્તિઃ । શાન્તિઃ ॥ શાન્તિઃ ॥।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ

卐 શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર 卐

ॐ नमो श्री निष्कलंकी नारायण जनार्दनाय ।

भस्मायुधाय विद्महे दिव्यनेत्राय धीमही ॥

तन्नोज्वरहरः प्रचोदयात् ।

ॐ शान्तिः ! शान्तिः !! शान्तिः !!!

●●●

ॐ

सप्तऋषीनभ्यावर्ते ।

ते मे द्रविणं यच्छन्तु ते मे ब्राह्मणवर्चसम् ॥३९॥

ब्रह्माभ्यावर्ते ।

तन्मे द्रविणं यच्छन्तु तन्मे ब्राह्मणवर्चसम् ॥४०॥

अथर्व वेद : कांड-१०, सुक्त-५, मंत्र-३९, ४०.

॥ કળશને પ્રદક્ષિણા કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

શ્રી બ્રહ્મા વાચા ।। શ્રી વિષ્ણુ વાચા ।। શ્રી મહેશ વાચા ।। શ્રી આદ્ય નારાયણ વાચા ।। શ્રી આદ્ય શક્તિ વાચા ।। શ્રી મત્સ્ય વાચા ।। શ્રી કૂર્મ વાચા ।। શ્રી વરાહ વાચા ।। શ્રી નૃસિંહ વાચા ।। શ્રી વામન વાચા ।। શ્રી પરશુરામ વાચા ।। શ્રી રામ વાચા ।। શ્રી કૃષ્ણ વાચા ।। શ્રી બુદ્ધ વાચા ।। શ્રી નિષ્કલંકી નારાયણ વાચા ।। જો પ્રદક્ષિણા કરીને પૂજીએ ઘટ ને પાટ તો સોહેલી થાયે અમરાપુરની વાટ ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

• • •

ॐ

येऽस्यां स्थोदीच्यां दिशि प्रविध्यन्तो
नाम देवास्तेषां वो वात इषवः ।
ते नो मृडत ते नोऽधि ब्रूत तेभ्यो
वो नमस्तेभ्यो वः स्वाहा ।।४।।

अथर्व वेद : कांड-३, सुक्त-२६, मंत्र-४.

॥ કળશને ઉત્તર દિશાએ ઉદક મૂકવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ।। ચાર ખાણ ।। ચાર વાણ ।। ચાર વેદ ।। પંચ દેવ ।। સપ્ત ઋષિ ।। ચૌદ ભુવન ।। દશ અવતાર ।। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરના કુળ કાયમનો પરિવાર ।। સ્વામી ! તમે કળશમાં કળા ધરો ।। ઘટ માંહે તમારો વાસ પૂરો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

ये३स्यां स्थ प्राच्यां दिशि हेतयो
नाम देवास्तेषां वो अग्निरिषवः ।
ते नो मृडत ते नोऽधि ब्रूत तेभ्यो
वो नमस्तेभ्यो वः स्वाहा ।।१।।

अथर्व वेद : कांड-३, सूक्त-२६, मंत्र-१.

।। કળશને પૂર્વ દિશાએ ઉદક મૂકવાનો મંત્ર ।।

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ધરતી આકાશ ॥ પવન પાણી ॥ અઢાર ભાર વનસ્પતિ ॥ એકવીસ બ્રહ્માંડ ॥ સાત દ્વીપ ॥ સાત સાહેર ॥ નવસેં નવ્વાણુ નદીઓ ॥ અષ્ટ કુળ પર્વત ॥ નવ કુળ નાગ ॥ બાર કુળ મેઘ ॥ દશ દિશા ॥ દશમો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ ॥ સ્વામી ! તમે કળશમાં કળા ધરો ॥ ઘટ માંહે તમારો વાસ પૂરો ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

• • •



ॐ

येऽस्यां स्थ दक्षिणायां दिश्य विष्यवो
नाम देवास्तेषां वः काम इषवः ।
ते नो मृडत ते नोऽधि ब्रूत तेभ्यो
वो नमस्तेभ्यो वः स्वाहा ।।२।।

अथर्व वेद : कांड-३, सुक्त-२६, मंत्र-२.

॥ કળશાને દક્ષિણ દિશાએ ઉદક મૂકવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે....

શ્રી તુળજા દેવી ॥ સીતા ॥ કુંતા ॥ તારા ॥ દ્રૌપદી ॥ કનકા શક્તિ ॥ રૂક્ષ્મણી ॥ શક્તિ માતા કાલીકા ॥ યોગમાયા ॥ અલખ નિરંજને સંસાર નિપાયા ॥ અઠ્યાસી સહસ્ત્ર ઋષિ ॥ સોળ કરોડી કુળ પરિવાર ॥ છત્રીસ કરોડી કુળ પરિવાર ॥ નવ્વાણું કરોડી ઝાંખા કુળ પરિવાર ॥ છપ્પન કરોડી મેઘા કુળ પરિવાર ॥ બત્રીસ કરોડી કિન્નર કુળ પરિવાર ॥ તેત્રીસ કરોડી દેવતા ॥ અનંત કરોડીના તારણહાર ॥ સ્વામી ! તમે કળશમાં કળા ધરો ॥ ઘટ માંહે તમારો વાસ પૂરો ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

येऽस्यां स्थ प्रतीच्यां दिशि वैराजा
नाम देवास्तेषां व आप इषवः ।
ते नो मृडत ते नोऽधि ब्रूत तेभ्यो
वो नमस्तेभ्यो वः स्वाहा ।।३।।

अथर्व वेद : कांड-३, सूक्त-२६, मंत्र-३.

॥ કળશાને પશ્ચિમ દિશાએ ઉદક મૂકવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર

ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ચંદ્ર સૂર્ય ।। નવલખ તારા ।। સપ્ત ઋષિ ।। નિરંજન નિરાકાર ।। સાત આસમાન તે વૈકુંઠ દ્વાર ।। કહે સદ્‌ગોર બ્રહ્મા સત્‌પંથ સદા ઉત્તમમ્ ।। મુક્તિ માર્ગનો ભેદ તે બ્રહ્મ દ્વાર ।। સ્વામી ! તમે કળશમાં કળા ધરો ।। ઘટ માંહે તમારો વાસ પૂરો. ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

•••

ॐ

ऊर्ध्वायै त्वा दिशे बृहस्पतयेऽधिपतये श्वित्राय रक्षित्रे वर्षायेषुमते ।
एतं परि दद्मस्तं नो गोपायतास्माकमैतोः ।
दिष्टं नो अत्र जरसे नि नेषज्जरा मृत्यवे परि णो ददात्वथ पक्वेन सह सं भवेम ॥६०॥

अथर्व वेद : कांड-१२, सूक्त-३, मंत्र-६०.

॥ દશે દિશાએ દેવોને ઉદકથી અભિષેક કરી છાંટ નાખી પગે લાગવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ૐ કાર ॥ બિંબાકાર ॥ મહાકાર ॥ ભૂમાકાર ॥ નિરંજન નિરાકાર ॥ આદ્યે રોપ્યા ચતુર સ્થંભ ॥ તળે માંડ્યો પાટને ઉપર કુંભ ॥ કુંભમાં બેઠી મૂરત ચાર ॥ માંહે નિરંજન નિરાકાર ॥ ચાર પુરુષને શક્તિ સાર ॥ માંહે સાત દર્શનનો આચાર ॥

પ્રદક્ષિણાનું મોટું દાન ।। પૂજીએ તો મેરુ સમાન ।। કહી આદેશને નાખી છાંટ ।। ત્યારે ધરતી આસમાન રહ્યાં સત્ય સમાન ।। ચતુર્દિશા ને ખૂણા ચાર ।। ખગોળ ભૂગોળ સૌ વિસ્તાર ।। સત્ય સંતોષે ઈંડ આકાર ।। ઈંડ થકી રચ્યો સંસાર ।।

કુંભે નૂર કળશનો ભેદ ।। યજ્ઞ સ્થાપ્યો વારિમેધ ।। અથર્વવેદી યજ્ઞ નિશાની ।। વિશ્વંભરા ભોજન ।। એક મૂરત ત્રણ દેવ મળી સૃષ્ટિ જ્યારે સ્થાપી ।। ત્યારે આદ્ય સત્પંથ ધર્મ સ્થાપ્યા ને પાપ નાખ્યાં કાપી ।। આશ પૂરો ।। વાસ ધરો ।। નૂરનો પ્રકાશ કરો ।। કળશ માંહે કળા ધરો ।। ઋષિવર જીવને પાવન કરો ।। વિષ્ણુ નિરંજન નિષ્કલંકી રૂપ ।। તમે સકળ સૃષ્ટિના ભૂપ ।। સદ્‌ગુરુએ કીધી મહેર ।। વધાર્યા ધર્મ ને ટાળ્યાં કહેર ... ।। સદ્‌ગોર તે નિરંજનની કાયા ।। સ્વામી તમથી ઉપન્યા તમમાં સમાયા ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति ।

स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः ॥१॥

अथर्व वेद : कांड - १०, सूक्त - ८, मंत्र - १

॥ સર્વ દેવ ઋષિવરને નમસ્કારનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

આદ્ય નારાયણને નમસ્કાર ॥ આદ્ય શક્તિને નમસ્કાર ॥ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરને નમસ્કાર ॥

શ્રી નિષ્કલંકી નારાયણને નમસ્કાર ।। પ્રથમ પુરુષને નમસ્કાર ।। સપ્ત ઋષિઓને નમસ્કાર ।। હરિઅંશ કુળ કાયમના પરિવારનો નમસ્કાર ।। ધરતી આસમાનને નમસ્કાર ।। પવન-પાણીને નમસ્કાર ।। ચંદ્ર-સૂર્ય ને નમસ્કાર ।। રવિમંડળને નમસ્કાર ।। ધ્રુવ મંડળને નમસ્કાર ।। નવ લાખ તારાને નમસ્કાર ।। બાર મેઘને નમસ્કાર ।। નવ કુળ નાગને નમસ્કાર ।। સાત સમુદ્રને નમસ્કાર ।। નવસો નવ્વાણું નદીઓને નમસ્કાર ।। ગણપતિ દેવને નમસ્કાર ।। હનુમાન જતીને નમસ્કાર ।।

આઠ વસુને નમસ્કાર ।। અગીયાર રુદ્રને નમસ્કાર ।। બાર આદિત્યને નમસ્કાર ।। અશ્વિનીકુમારોને નમસ્કાર ।। ઓગણપચાસ મરુતને નમસ્કાર ।। એકવીસ બ્રહ્માંડને નમસ્કાર ।। સ્વર્ગ મૃત્યુ પાતાળને નમસ્કાર ।। સાત વાર, સત્તાવીશ નક્ષત્રને નમસ્કાર ।। પંદર તિથિ, બાર કરણને નમસ્કાર ।। નવ

ગ્રહને નમસ્કાર ।। સાત દ્વીપને નમસ્કાર ।। નવખંડ પૃથ્વીને નમસ્કાર ।। ચોવીસ મુલકને નમસ્કાર ।। અષ્ટ કુળ પર્વતને નમસ્કાર ।। અઢાર ભાર વનસ્પતિને નમસ્કાર ।। ચાર વેદને નમસ્કાર ।। ચાર ખાણ ચાર વાણને નમસ્કાર ।। અગ્નિ, તેજ, અન્નદેવને નમસ્કાર ।। આદ્ય, અંત, મધ્યના દેવોને નમસ્કાર ।। બાર રાશીઓને નમસ્કાર ।। કુળ ગોત્રના દેવોને નમસ્કાર ।। પિતૃદેવોને નમસ્કાર ।। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમને નમસ્કાર ।। દશ દિગ્પાળને નમસ્કાર ।। દશે દિશાઓને નમસ્કાર ।।

નવનાથ, ચોર્યાસી સિદ્ધને નમસ્કાર ।। ચોસઠ લાખ દેવીઓને નમસ્કાર ।। અઠ્યાસી સહસ્ત્ર ઋષિઓને નમસ્કાર ।। સર્વ સંત મહાત્માઓને નમસ્કાર ।। અડસઠ તીર્થને નમસ્કાર ।। નવ્વાણુ કરોડી ઝાંખાને નમસ્કાર ।। છપ્પન કરોડી મેઘાને નમસ્કાર ।। બત્રીસ કરોડી કિન્નરને નમસ્કાર ।। પાંચ કરોડી પ્રહલાદને નમસ્કાર ।। સાત કરોડી હરિશ્ચંદ્રને નમસ્કાર ।। નવ કરોડી યુધિષ્ઠિરને

નમસ્કાર ।। બાર કરોડી સદ્‌ગુરુદેવને નમસ્કાર ।। અનંત કરોડી કમળાકુંવરને નમસ્કાર ।। તેત્રીસ કરોડી દેવતાઓને નમસ્કાર ।। સર્વ ઋષિવર ગત્-ગંગાને નમસ્કાર ।। દશે અવતારોને નમસ્કાર ।। મુખી સેવકને નમસ્કાર ।। ચૌદ ભુવન ના દેવ-ઋષિવરોને નમસ્કાર ।। કરણ કલ્પના અનંત કરોડી દેવોને નમસ્કાર ।। સ્વામી ! અમારા અપરાધ ક્ષમા કરો ।। સત્‌પંથના માર્ગ માંહે રાખો ।। લખ ચોર્યાસીના ફેરા ટાળો ।। તેત્રીસ કરોડના મેળા આપો ।। જાંબુદ્વીપના ધણી !

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

अग्नाविष्णू महि तद्वां महित्वं पाथो घृतस्य गुह्यस्य नाम ।
दमे दमे सप्त रत्ना दधानौ प्रति वां जिह्वा घृतमा चरण्यात् ॥१॥

अथर्व वेद : कांड-७, सूक्त-२९, मंत्र-१.

॥ મંત્ર પહેલો : શ્રી વિષ્ણુ ભગવાનને થાળ ધરાવવાનો મંત્ર ॥

(થાળ પહેલો : લાવસીનો ધરાવવો)

(થાળ ઉપર ચરણામૃત અને તુલસી પત્ર મૂકી, મંત્ર બોલી થાળ સમર્પણનો સંકલ્પ કરવો)

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! તમે આદ્ય રૂખ ॥ પછી અલેખ ॥ ચતુર ગુણમાં તમે એક ॥ ૐ કાર, નિરંજન નિરાકાર ॥ ઉપજ્યા પિંડ તે સાકાર ॥ નિરંજને તો કૃપા કરી ॥ સત્ય સીંચીને ઉપજ્યા હરિ ॥ હરિએ ત્યાં ધર્યા અવતાર ॥ તમે નિરંજન નિરાકાર ॥ ચતુર્વેદનો કીધો વિસ્તાર ॥ ચતુર્યુગમાં દશ અવતાર ॥

સ્વામી શ્રી મત્સ્ય ॥ સ્વામી શ્રી કૂર્મ ॥ સ્વામી શ્રી વરાહ ॥ સ્વામી શ્રી નૃસિંહ ॥ સોળ કરોડી કુળ પરિવાર ॥ સ્વામી શ્રી વામન ॥ સ્વામી શ્રી પરશુરામ ॥ સ્વામી શ્રી રામ અવતાર ॥ છત્રીસ કરોડી કુળ પરિવાર ॥ સ્વામી શ્રી કૃષ્ણ ॥ સ્વામી શ્રી બુદ્ધા અવતાર ॥ છપ્પન કરોડી કુળ પરિવાર ॥ સ્વામી શ્રી નિષ્કલંકી નારાયણ દશમો અવતાર ॥ હરિ અંશ કુળ કાયમનો પરિવાર ॥ સદ્‌ગોર ઈમામશાહ ॥ નિરંજન નિષ્કલંકી નારાયણ ॥ તમારે નિમિત્તે ॥ તમારે ભોજન સ્થળે ॥ મુનિવર, ઋષિવર, સેવક, નર, નારી, બાલ ગોપાલની થાળ બત્રીસી સ્વીકાર કરો ॥ હે દેવ !

તમ સમક્ષ જે ધર્યું ધરાવ્યું હોય તેનો સ્વીકાર કરો ।। પંચાયતન દેવ પવિત્ર આત્માઓ ।। નવ તન શાખ ।। દેવ આશિષ તમારી ।। પ્રાર્થના અમારી ।। તમે સ્વીકાર કરો ।। તમારે ભાવે સ્વભાવે ।। તમારા નિમિત્તે ।। તમારા બ્રહ્મ ભોજન સ્થાને ।। તમે સ્વીકાર કરો ।। અન્ન પાણીના આહાર ।। પાન-ફળના ભોક્તા ।। તમે દાતા ।। તમે ભોક્તા ।। કર્મ તમારાં ।। ધર્મ તમારાં ।। ભાવ, ભક્તિ, શ્રદ્ધા અમારાં ।। સ્વામીજી ! તમે સ્વીકાર કરો ।। આજ કલિયુગમાં દર્શન આપો ।। અથર્વવેદને વાયકે ।। હો સ્વામીજી ! નિરંજન નિષ્કલંકી નારાયણ ।। મુખી ...સેવકોની આશિષે ।। પંચ ભાગ સ્વીકારો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति ।
स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः ॥१॥

अथर्व वेद : कांड - १०, सूक्त - ८, मंत्र - १

॥ મંત્ર બીજો : શ્રી બ્રહ્માજીને થાળ ધરાવવાનો ॥

(થાળ બીજો : શીરાનો ધરાવવો.)

(થાળ ઉપર ચરણામૃત અને તુલસી પત્ર મૂકી, મંત્ર બોલી થાળ સમર્પણનો સંકલ્પ કરવો.)

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ

તમારી આશિષે...

નિરંજન નામ તે નિરાકાર ।। ઇંડ થકી કીધો વિસ્તાર ।। કર પર કીધું દષ્ટે કામ ।। ત્યારે આપો આપ વધ્યા પ્રમાણ ।। નાભિએ વધ્યું કમળ સાર ।। ઉપજ્યા બ્રહ્મા ૐ કાર ।। અનંત બ્રહ્મા થયા મલઘ્ન ।। હરિ હાથમાં થયા હંસ ।। બ્રહ્મ તનથી બુંદ જ ખર્યા ।। અનંત કરોડી જીવ અવતર્યા ।। રચી ખાણને વર્ત્યા વેદ ।। સર્જ્યા સત્‌પંથને અમર ભેદ ।। બ્રહ્મા, વિષ્ણુએ ધર્યા અવતાર ।। અંશ એક ને જુદા પરિવાર ।। અંશે જેવા ચંદ્રમા સૂર્ય ।। ધરી અવતારને સર્જ્યા નૂર ।। વેદ અંશ જે અમર ભેદ ।। પ્રગટ્યા બ્રહ્મા ચારે વેદ ।। ચો મુખા બ્રહ્મા અમર તેજ ।। પાંચમે મુખે અમર ભેદ ।। વસિષ્ઠ ।। વેદમ વ્યાસ ।। હંસ તેજ પ્રકાશ ।।

શ્રી મત્સ્ય ।। શ્રી કૂર્મ ।। શ્રી વરાહ ।। શ્રી નૃસિંહ ।। શ્રી વામન ।। શ્રી પરશુરામ ।। શ્રી રામ ।।

શ્રી કૃષ્ણ ।। શ્રી બુદ્ધ ।। શ્રી નિષ્કલંકી નારાયણ ।। શક્તિ માતા ।। સદ્ગોર સ્વામી ।। નિરંજન નિષ્કલંકી નારાયણ ।। તમારે નિમિત્તે ।। તમારે બ્રહ્મ ભોજન સ્થળે ।। મુનિવર ।। ઋષિવર ।। સેવક ।। નરનારી ।। બાલગોપાલની ।। થાળ બત્રીસીનો સ્વીકાર કરો ।। તમારી સમક્ષ જે ધર્યું ધરાવ્યું હોય તેનો સ્વીકાર કરો ।। તમારા અરવાર - પરિવાર સાથે સ્વીકાર કરો ।। તમારે કર્મે ।। તમારે ધર્મે સ્વીકાર કરો ।। સેવકના ભાવે-સ્વભાવે સ્વીકાર કરો ।। તમારી આસના વાસનાએ સ્વીકાર કરો ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

नमस्ते घोषिणीभ्यो नमस्ते केशिनीभ्यः ।
नमो नमस्कृताभ्यो नमः संभुञ्जतीभ्यः ।
नमस्ते देव सेनाभ्यः स्वस्ति नो अभयं च नः ॥३१॥

अथर्व वेद : कांड-११, सूक्त-२, मंत्र-३१.

॥ મંત્ર ત્રીજો : શ્રી મહેશ્વર દેવને થાળ ધરાવવાનો ॥

(થાળ ત્રીજો ખીર રોટલીનો ધરાવવો)

(થાળ પર ચરણામૃત અને તુલસી પત્ર મૂકી,
મંત્ર બોલી થાળ સમર્પણનો સંકલ્પ કરવો.)

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ૐ કારથી આદ્ય નિરંજને ધરીયા હેત ।। લલાટથી લીધા સ્વેદ ।। સ્વેદ લઈને ધ્યાન ધરી રહ્યા ।। લખ ચંદરણા ધૂંધૂકાર વહી ગયા ।। કર મધ્યે ધ્યાન ધરી રહ્યા ।। છત્રીસ યુગને ચોર્યાસી ચોકડી વહી ગયા ।। તદા સ્વેદથી નીર ।। નીરથી ક્ષીર ।। ક્ષીરથી ફીણ ।। ફીણથી ઈંડ ।। ઈંડથી કીધા પ્રકાશ ।। ચતુર ગુણને ધરતી આકાશ ।। નૂરથી સર્જ્યા સર્વે જાત ।। ચૌદ ભુવનને સપ્ત ઋષિ ।। તમે નિરંજન અમર દેવ ।। મસ્તકથી ઉપન્યા મહાદેવ ।। હૈયે વિષ્ણુ, નાભિએ બ્રહ્મા ।। જાંઘ સ્થળે ઈચ્છા કરી ।। અંગ થકી અર્ધાંગના ઉપની ।। ઉપજી શક્તિ ને માયા પરવરી ।। ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરી ।। માયા માંહે ધર્યો સંતોષ ।। ત્યારે નિપજ્યા ચૌદે લોક ।। આદિ

સર્જ્યા ત્રણ જ ટોળ ।। નહિ વાચા ને નહિ ત્યાં બોલ ।। બ્રહ્માને કર્યો આદેશ ।। જઈ બ્રહ્માએ કીધું જાણ ।। બે ટોળ વિમુખ થયા અને એકે રાખી શ્રદ્ધા ।। શ્રદ્ધાળુને આપ્યો સત્‌પંથ ધર્મ ।। છૂટયા લક્ષ ચોર્યાસીના ફંદ ।। ઋગ્વેદની દેખાડી વાટ ।। સોંપ્યા યજ્ઞ કળશ ને પાટ ।।

સ્વામીજીએ જીવ ઉદ્ધાર્યા ।। નવ્વાણુ કરોડી ઝાંખા ।। છપ્પન કરોડી મેઘા ।। બત્રીસ કરોડી કિન્નર ।। તેત્રીસ કરોડી દેવતા ।। તે ઘટ-પાટ સેવતા ।। નરસિંહ ।। અમરતેજ ।। રામ ।। વસિષ્ઠ ।। કૃષ્ણ ।। વેદમવ્યાસ ।। બ્રહ્મેશ્વર ।। બુદ્ધેશ્વર ।। બુદ્ધેશ્વર થી હરિઅંશનો વિસ્તાર ।। અંશ એક ને જુદા પરિવાર ।। બ્રહ્મા પરિવાર ।। વિષ્ણુ પરિવાર ।। શિવ પરિવાર ।। શક્તિ પરિવાર ।। તમારો પરિવાર ।। પ્રહલાદ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, કમળાકુંવર ।। સદ્‌ગોર ઈમામશાહ ।। નિરંજન નિષ્કલંકી નારાયણ ।। તમારા

નિમિત્તે ॥ તમારા બ્રહ્મ ભોજન સ્થાને ॥ મુનિવર ॥ ઋષિવર ॥ સેવક ॥ નરનારી ॥ બાલ-ગોપાલની ॥ થાળ - બત્રીસીનો સ્વીકાર કરો ॥ કુળ પરિવાર ॥ સપ્ત ઋષિ સહિત સ્વીકાર કરો ॥ તમારા વારાની સંગતે ॥ ખાણું-નિશાની સ્વીકાર કરો ॥ શિવ શક્તિ પરિવાર ॥ વિષ્ણુ પરિવાર ॥ બ્રહ્મા પરિવાર ॥ ચતુર કુળ તમે ॥ નિરંજન આશિષ આપીને સ્વીકાર કરો ॥ તમે દાતા ॥ તમે ભોક્તા ॥ કર્મ તમારું ॥ ધર્મ તમારું ॥ માનું ગુણ તમારા ॥ જમો તમે ॥ જમાડો તમે ॥ સેવક અપરાધી ॥ સ્વામીજી ! તમે સેવકના અપરાધ ક્ષમા કરો ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

या विश्पत्नीन्द्रमसि प्रतीची सहस्त्रस्तुकाभियन्ती देवी ।
विष्णोः पत्नि तुभ्यं राता हवींषि
पति देवि राधसे चोदयस्य ।।३।।

अथर्व वेद : कांड-७, सूक्त-४६, मंत्र-३.

॥ मंत्र चोथो : श्री आद्यशक्ति माताने थाळ धरावવાનો ॥

(થાળ ચોથો ચૂરમાનો ધરાવવો)

(થાળ પર ચરણામૃત અને તુલસી પત્ર મૂકી, મંત્ર બોલી થાળ સમર્પણનો સંકલ્પ કરવો)

આદેશ = હરિ ॐ

ॐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ॐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ આદ્ય નિરંજન ધૂંધૂકાર ।। સૃષ્ટિ તણો કીધો વિસ્તાર।। આપે ઉપજ્યા ઇંડ આકાર।। ઇંડ માંહે ધર્યા અવતાર ।। લીલા ઇચ્છા અનંત અપાર ।। તમે નિરંજન નિરાકાર।। કરી ક્રોધને ઊંચે શ્વાસ।। નિરંજન થયા પ્રકાશ ।। પહેલા શબ્દ ૐ કાર ।। ત્યાં ઉપજ્યા નિરાકાર ।। હતું તેજ નિલવર્ણ ધૂંધૂકાર ।। પેદા કીધાં તત્ત્વ ચાર ।। ચતુર ગુણને ચતુર રંગ ।। ચતુર ખાણને ચતુર વાણ।। ચતુર વેદે કર્મ ધર્મના સજર્યા ભેદ।। ધર્મે તો સજર્યો સંસાર।। કર્મ તમે કર્યું કિરતાર।। માયાનો કીધો વિસ્તાર ।। શક્તિ રૂપે રચ્યો સંસાર।।

નિરંજને તો કર્તવ્ય કરી ।। ઇચ્છા લીલા પ્રગટ ધરી ।। ચૌદ ભુવનને ધરતી આકાશ ।। પવન, પાણી કીધાં પ્રકાશ ।। અષ્ટકુળ પર્વત ।। સમુદ્ર સાત ।। નવ ખંડ પૃથ્વી ।। દ્વીપ જ સાત ।। બાર કુળ મેઘ ।। નવ કુળ નાગ ।। ચંદ્ર, સૂર્ય મેલ્યા શાખ ।। નવલખ તારા ધર્યા આકાશ ।। નવસો નવ્વાણું નદીઓ જાણ ।। અડસઠ તીરથ સહી પ્રમાણ ।। પંદર તિથિને કરણ બાર।। નવ લાખ તારાનો વિસ્તાર।। સરસ્વતી, વનસ્પતિ

ભાર અઢાર ॥ અગ્નિ, લક્ષ્મી સહી પ્રકાશ ॥ ચૌદ લોકમાં દિવસને રાત ॥ ગ્રહ નક્ષત્ર ॥ સંવત્સર માસ ॥ દશ ખુણા ને દશ દિક્પાળ ॥ શાંત સ્થાને ભિતર- બહાર ॥ ભિતર તો સર્જ્યો સંસાર ॥ બહાર વર્ત્યો ધૂંધૂકાર ॥

ગોર-નરે ધર્યા અવતાર ॥ સ્વામી નિરંજન નિરાકાર ॥ શ્રી મત્સ્ય-શ્રી એકાઋષિ ॥ શ્રી વામન-શ્રી સહજાનંદ ॥ શ્રીકૃષ્ણ-શ્રી વેદમવ્યાસ॥ શ્રી નિષ્કલંકી નારાયણ- સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ ॥ સદ્ગોર સ્વામી ॥ તમો જીવોના સર્જનહાર ॥ ઋષિવર સેવકોનો કરો ઉદ્ધાર ॥ આઠ લાખ કરણના અનંત કરોડી દેવ ॥ ચતુર કલ્પના દેવ ॥ નવાણું કરોડી ઝાંખા ॥ છપ્પન કરોડી મેઘા ॥ બત્રીસ કરોડી કિન્નર ॥ તેત્રીસ કરોડી દેવતાઓએ પૂરી શાખ ॥ ઋષિવર જીવોને કરો પાક ॥ ઋષમાગત, અમરિષ, ધ્રુવ, પ્રહલાદ, કમળધ્વજ, કમળાપતિ, હરિશ્ચંદ્ર, સહદેવ, યુધિષ્ઠિર, કમળાકુંવર ॥ નવ નાથ ચોર્યાસી સિદ્ધ ॥ અઠ્યાસી સહસ્ત્ર ઋષિઓ ॥ ધાયા સત્પંથ

જાણી ॥ જેણે લીધી અથર્વવેદની વાણી ॥ શક્તિ માયા યોગણી ॥ જેણે જેર કીધો જગત ॥ યતિ , સતી , સાર, પરજા, તારા, મંદોદરી, ચંદ્રાવતી, દ્રૌપદી, સુરજા રાણી ॥ તમે ધાયા સત્‌પંથ જાણી ॥ જેણે લીધી અથર્વવેદની વાણી ॥ અથર્વવેદી ઋષિઓ ॥ એક લાખ એંસી હજાર સંત મહાત્માઓ ॥ બ્રહ્મલીન ભક્ત શિરોમણી ॥ સર્વ ધર્મના ભક્તોના તારણહાર ॥ સત્ય સ્વામી તમને નમસ્કાર ॥

નિરંજન નારાયણ ॥ તમારા નિમિત્તે ॥ આલોક, પરલોક, દેવલોક, મહરલોક, અમરાપુરીના, જળના, સ્થળના ॥ અધિકારી પંચ ભાગ સ્વીકારો ॥ નિરંજન નિષ્કલંકી અવતાર ॥ ઋષિવરોને દર્શન દેજો ॥ ઋષિવર સર્વેનો કરો ઉદ્ધાર ॥ સ્વામીજી ! શક્તિ માતા ! નિરંજન નિષ્કલંકી નારાયણ ! સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ ! તમારા નિમિત્તે ॥ તમારા ભોજન સ્થાને ॥ મુનિવર, ઋષિવર, સેવક, નરનારી, બાલ-ગોપાલની થાળ-બત્રીસી સ્વીકારો ॥ તમારી સમક્ષ ધર્યું-ધરાવ્યું હોય

તે સ્વીકારો ।। તમારે કર્મે, તમારે ધર્મે સ્વીકારો ।।

હે નિરંજન સ્વામી ! તમારી સંગતે ।। ગોર-નરની સંગતે ।। તમારા અરવાર-પરિવારની સંગતે ।। મહાદેવની સંગતે ।। થાળ સ્વીકારો ।। તમારા વારાની સંગતે ।। ગોર-નરની સંગતે ।। ગોર-નરના જાપની સંગતે ।। વખત વેળા વારાનું વર્તમાન ।। અથર્વવેદના જ્ઞાન-ધ્યાનની સંગતે ।। થાળનો સ્વીકાર કરો અને કરાવો ।। ઓ અલખ નિરંજન સ્વામી ! તમે કરો જીવોનાં કામ ।। શક્તિ માતા તમને પ્રણામ ।। તમારા સંગ સોબતની સંગતે થાળનો સ્વીકાર કરો અને કરાવો ।।

તમારા પ્રકાશની સંગતે ।। તમારા નામની સંગતે ।। તમારા મંત્ર-જાપની સંગતે ।। થાળનો સ્વીકાર કરો અને કરાવો ।। મુકામ જાંબુદ્વીપે, કુંવારિકા ક્ષેત્રે ।। સદ્‌ગુરુએ કીધાં ઠામ ।। તે સ્થળની સંગતે થાળનો સ્વીકાર કરો અને કરાવો ।। સાડત્રીસ પાત્ર, આડત્રીસમા નરની સંગતે ।। તેવીસ પાત્ર, ચોવીસમા નારાયણની સંગતે ।। થાળ સ્વીકાર કરો

અને સ્વીકાર કરાવો ॥

ચાર વેદ ॥ ચાર ગોર વાચા ॥ ચતુર અંશે ॥ શક્તિ પરિવાર ॥ આદ્ય શબ્દ ૐ કારની સંગતે ॥ થાળનો સ્વીકાર કરો અને સ્વીકાર કરાવો ॥ સ્વામી ! તમારા કર્યા કરાવ્યાની સંગતે ॥ સ્વામી ! તમારી ઈચ્છા ॥ સ્વામી ! તમારી લીલા ॥ સ્વામી ! તમારા સર્જ્યા, તમારા સર્જાવ્યાની સંગતે ॥ થાળનો સ્વીકાર કરો અને સ્વીકાર કરાવો ॥ બ્રહ્મા વિષ્ણુના દશે અવતારની સંગતે ॥ થાળનો સ્વીકાર કરો અને સ્વીકાર કરાવો ॥ સ્વામી ! તમો પવિત્ર ॥ અમો સેવક ચરણ રજ ॥ નવ તન શાખ ॥ નિરંજન ! તમારી સંગતે થાળનો સ્વીકાર કરો અને સ્વીકાર કરાવો ॥ અમો સેવક અપરાધી ॥ સ્વામી ! તમો અપરાધ ક્ષમા કરનાર છો ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●

ॐ

मयि देवा द्रविणमा यजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः ।

दैवा होतारः सनिषन्न एतदरिष्टाः स्याम तन्वा सुवीराः ॥५॥

अथर्व वेद : कांड - ५, सूक्त-३, मंत्र-५.

॥ મંત્ર પાંચમો : સર્વદેવ-ઋષિવરને થાળ ધરાવવાનો ॥

(બાધા-માનતા પ્રકાશી દાન-દશાંશ તેમજ દક્ષિણા મૂકવી)

(થાળ પર ચરણામૃત અને તુલસી પત્ર મૂકી, મંત્ર બોલી થાળ સમર્પણનો સંકલ્પ કરવો.)

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

હે સ્વામીજી ! હરિઅંશ પાત્ર ।। તમે જીવોના આધાર ।। સૃષ્ટિના સર્જનહાર ।। જાંબુદ્વીપે ધર્યો અવતાર ।। તમે અવિચળ ।। તમારી વાચા અવિચળ ।। તમારું આસન અવિચળ ।। તમે સ્થાનકના ધણી ।। તમે રચના રચી ચૌદ ભુવન તણી ।।

તમારે પારે ।। તમારે નિમિત્તે ।। તમારા બ્રહ્મ ભોજન સ્થાને ।। તમારા મંદિરે ।। તમારા દેવસ્થાને ।। જે કોઈ મુનિવર ।। ઋષિવર ।। સેવક હીણો ખીણો ।। નર-નારી ।। જે કોઈ મનની ઈચ્છાએ ।। તમારા ભંડારમાં ભાવ કરીને ।। તમારે બ્રહ્મ ભોજન સ્થાને ।। જે કોઈ સેવકે માન્યું ઈચ્છ્યું હોય ।। જે કોઈ સેવકે દમડો, દોકડો, સૂત્ર, વસ્ત્ર, કણ, કાંકણ, દાણો, ખાણું ।। ત્રાંબુ, રૂપું, હેમ , કુંદન , ઢબુ , પૈસા ।।

દામ, મહોર, કોરી, બદામ, રૂપાનાણું ।। અન્ન, પાણી, પાન, ફૂલ, શાક, પાક ।। જે કોઈ સેવક ।। તમારા દરબારમાં ભાવથી ગત્-ગંગામાં પૂજે ।। આશિષ કરાવે તે બારે રાશીની આસનાનો સ્વીકાર કરો ।।

હે સ્વામી ! સેવકોના અન્ન પાણીના ભંડાર અખૂટ કરો ।। કમાણીમાં લાભ આપો ।। વાટ-ઘાટ સોહેલી કરો ।। દુઃખ દોહેલાં દૂર કરો ।। ઋષિવર સેવકો પર દયાની દ્દષ્ટિ કરો ।। સેવકોની ખેતી-વાડી, વણજ, વેપારમાં લાભ પૂરો ।। આવાગમન દૂર કરો ।। એક ઘણું દાન સવા લાખ ઘણું પુણ્ય ।। એક વાર દાન ઋષિવર દે ।। તે સવા લાખ ઘણેરું લે ।। સ્વામી સદ્ગુરુ પાત્ર બ્રહ્મા ।। ઈંદ્ર ઈમામશાહ મહારાજ તેની શાખ ભરે ।। નિરંજન નિષ્કલંકી નારાયણ આણ ધરે ।।

હરિ અંશ પરિવાર ।। આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ ।। તમે સેવકોની રક્ષા કરો ।।

સેવકોની પૂજા-પાત્રીનો સ્વીકાર કરો ॥ સેવકોને નીમે - ધર્મે ॥ સત્‌પંથના માર્ગ માંહે ભર્યા પૂરા રાખો ॥ દશાંશ સુક્રિતનો મેળો આપો ॥ ગત્‌ગંગામાં સાથે રાખો ॥ પંચ ભાગનો સ્વીકાર કરો ॥ મેરુ સમાન દાન ॥ વિશ્વંભર, ભોજન સ્વીકારો ॥ પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપો ॥ ઋષિવરોનાં પાપ કાપો ॥ આખર વેળામાં ઉગારી લેજો ॥ છેવટની પળે દર્શન દેજો ॥ ધર્મ શ્રદ્ધા અખંડ રાખો ॥

પાંચ, સાત, નવ, બાર, તેત્રીસ કરોડીના મેળા આપો ॥ લાખ ચોર્યાસીના ફેરા ટાળો ॥ ભક્ત કમળાકુંવરની સોબતમાં રાખો ॥ દશે આંગળીએ દાન ॥ સહસ્ત્ર ઘણું પુણ્ય ॥ (દેહતર દુનિયા , સહસ્ત્ર આખરત) ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

यत्ते नाम सुहवं सुप्रणीतेऽनुमते अनुमतं सुदानु ।
तेना नो यज्ञं पिपृहि विश्ववारे रयिं नो धेहि सुभगे सुवीरम् ॥४॥

अथर्व वेद : कांड - ७, सूक्त-२०, मंत्र-४.

॥ થાળ અક્ષય પાત્રનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે.....

હરિ ॥ ચતુર વેદી બ્રહ્મા ॥ મોક્ષ દાતાર ॥ દેવ મહેશ્વર અને સર્વ દેવોના તપે કરી ॥ કસે કળશ કિરતાર ॥ ચાર યુગ મધ્યે જીવ ઉદ્ધાર્યા ॥ પાંચ, સાત, નવ, બાર, તેત્રીસ કરોડીના મેળા આપો ॥

તમે હરિ અંશ પાત્ર સ્વામીજી ।। ભાવ ભક્તિ શુદ્ધ કરો ।। થાળ, પ્રસાદ, નિશાની, મહેમાની, દશાંશ, સુક્રિત ।। દામ, દોકડો, પાન, ફૂલ, ફળ, અન્ન, પાણી, શાક, પાક ।। ભક્તિ, ઉપાસના સ્વીકાર કરો ।।

સ્વામી ! તમસુ બલિહારી ।। અમને આશા દેવ તમારી ।। અક્ષય પાત્ર અખૂટ કરો ।। સ્વામી ! તમે ગત્-ગંગાને રોશન કરો ।।

અન્નપૂર્ણા મા ! અન્ન પૂરો ।। પાણી પૂરો ગણેશ ।। રિદ્ધિ -સિદ્ધિ આપો માતા ભવાની ।। મહાદેવ સ્વામી ભોજન પીરસો ।। માતા ભવાની ગયાં બ્રહ્માજીની પાસ ।। રિદ્ધિ-સિદ્ધિ આપો આ તમારા દાસને ।। દાસના ભરો ભંડાર, થાએ સુખી ।। અન્નદેવ પૂર્ણ જાલંધર મુખી ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया ।
पुनन्तु विश्वा भूतानि पवमानः पुनातु मा ।।१।।
पवमानः पुनातु मा, क्रत्वे दक्षाय जीवसे ।
अथो अरिष्टातातये ।।२।।

अथर्व वेद : कांड-६, सूक्त-१९, मंत्र-१,२.

॥ સ્ત્રીને છાંટ નાખી લાઈ સૂતક ઉતારવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

પ્રથમ આદ્ય નિરંજન ધૂંધૂકાર ।। તમે સરજી મૂરત ચાર ।। તમે સૃષ્ટિના સર્જનહાર ।। તમે કીધા વેદ વિસ્તાર ।। સ્વામી ! તમે ધર્યા અવતાર ।। અથર્વવેદમાં સચરાચર ।। ખાણી વાણી ને સર્જ્યા વેદ ।। તમે સર્જ્યા અમર ભેદ ।। અમર ભેદની અમર કાયા ।। આદ્ય અંતે નૂર નિપાયા ।। નૂરથી નિર્મળ જીવ નિપાયા ।। સ્વામી ! તમથી ઉપન્યા તમમાં સમાયા ।।

સૂતક ટાળો ।। પાતક બાળો ।। નૂરથી જીવના પિંડ પખાળો ।। સદ્ગુરુ સ્વામી ।। છાંટ નાખો ।। છોત ઉતારો ।। પાપની પોઠ ઉતારો ।। દિવસ ચાર, સાત, અગિયાર ને ચાલીસ દિવસનાં ।। સૂતક પાતક પ્રાયશ્ચિત્ત ઉતારો ।। જરાજ ખાણીમાં મનુષ્ય અવતાર ।। તમે ઉતારો સેવકનો ભાર ।। પર અન્ન ।। પર જળ ।। દુનિયા તણો વ્યવહાર ।। તમે નૂરથી કરો ઉદ્ધાર ।। સૂતક ટાળો ।। પાંચે પાતક બાળો ।।

સાચો, જૂઠો, ભૂલ્યો, ચૂક્યો ।। વાચા-વચને વેદ હીણો , ઉણિયાચારી ।। અવગુણ પાતકે ભર્યો ।। પાંચે પાતક દૂર કરો ।। વારો વાર લગી પાવન કરો ।। નૂરે કાંડી જપાવો અજંપા જાપ ।। તમે ઉતારો સેવકનાં પાપ ।। ગત્-ગંગાને સકળ સંઘ ।। અનેક વર્ણને એક જ અંગ ।। નૂરથી પાતક દૂર કરો ।। સદ્ગોર ઈમામશાહ મહારાજ ।। તમે જીવોના તારણહાર ।। તમે સેવકને આપો દર્શન ।। એ..... સેવકને પાવન કરો ।। એ...... સેવકના અપરાધ ક્ષમા કરો ।। જાંબુદ્વીપના ધણી ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया ।
पुनन्तु विश्वा भूतानि पवमानः पुनातु मा ॥१॥
पवमानः पुनातु मा, क्रत्वे दक्षाय जीवसे ।
अथो अरिष्टाततये ॥२॥

अथर्व वेद : कांड-६, सूक्त-१९, मंत्र-१,२.

॥ પુરુષને છાંટ નાખી સૂતક ઉતારવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી

નારાયણ તમારી આશિષે...

દેવ પાવન ।। નૂર પાવન ।। નિરંજન નારાયણ નામ પાવન ।। પંચ દેવ પાવન ।। ચૌદ ભુવન પાવન ।। સપ્ત ઋષિ પાવન ।। બાર કુળ મેઘ પાવન ।। તમારાં નામ પાવન ।। તમારાં ઠામ પાવન ।। તમારા નામ નૂરને પ્રતાપે કરીને એ..... જીવ પાવન ।।

ધરતી આસમાન પાવન ।। પવન પાણી પાવન ।। ચંદ્ર-સૂર્ય પાવન ।। તારા મંડળ પાવન ।। ધ્રુવ મંડળ પાવન ।। અષ્ટકુળ પર્વત પાવન ।। નવ કુળ નાગ પાવન ।। સાત સમુદ્ર પાવન ।। નવસો નવાણું નદીઓ પાવન ।। તમારા નામ-નૂરને પ્રતાપે કરીને સેવક પાવન ।।

નવ નાથ, ચોર્યાસી સિદ્ધ પાવન ।। અઠ્યાસી સહસ્ર ઋષિ પાવન ।। એક લાખ એંસી હજાર સંત મહાત્મા પાવન ।। હરિ અંશ કુળ કાયમના

અવતાર પાવન ।। અડસઠ તીર્થ પાવન ।। નવાણું કરોડી ઝાંખા પાવન ।। છપ્પન કરોડી મેઘા પાવન ।। બત્રીસ કરોડી કિન્નર પાવન ।। તેત્રીસ કરોડી દેવતા પાવન ।। અનંત કરોડી દેવો પાવન ।। તમારા નૂરના પ્રતાપે કરીને સેવકો પાવન ।। નૂરની છાંટે કરીને સેવકને કરો પાવન ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे ।
इन्द्रस्य युज्यः सखा ॥६॥

अथर्व वेद : कांड-७, सूक्त-२६, मंत्र-६.

॥ કળશ ઉપરથી અક્ષત ઉતારવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

આખે જીવ રાખે ॥ તો જીવ તણો હોય ઉદ્ધાર ॥ સૃષ્ટિના સર્જનહાર ॥ જમડા રૂઠ્યા કયા કરે ॥ જીસકા બેલી કિરતાર ॥ કર્તાને માનો ॥ કળશને નમો ॥ કળશને દીજે બહુ માન ॥ તેત્રીસ

કરોડી દેવ આવીયા ॥ તે ધરતા સ્વામીનું ધ્યાન ॥ સેવા કરે ॥ તે સફળ હોવે ॥ સ્વામી કરો સ્વીકાર ॥ નર નારાયણ ભેટીયા ॥ હાજર સદ્‌ગોર નૂર ॥

જે જીવ નૂરે મળ્યા ॥ તેના આવાગમનના ફેરા ટળ્યા ॥ કાયા જમીન ॥ જીવ અમર ॥ અમરાપુર વાસ ॥ સદ્‌ગોર મળે તો દર્શન નારાયણનાં થાય ॥ અમરગોઠ અમરાપુરી ॥ સદ્‌ગોર મળે તો જાય ॥ અહીં કરણી કમાઈએ તો દર્શન સ્વામીજીનાં થાય ॥ ૐ નમો શ્રી નિષ્કલંકી નારાયણ ॥ જનાર્દનમ્ ॥ અલખ નિરંજન ॥ પિતાંબર ॥ કેશવ ॥ માધવ ॥ દામોદર ॥ મધુસૂદન ॥ ગરુડધ્વજ ॥ આદ્ય વિષ્ણુ નારાયણ દેવ ॥ ૐકાર મધ્યે સેવ ॥ છત્રીસ યુગ ચોર્યાસી ચોકડી તમ મધ્યે ॥ આદ્ય બુદ્ધ શ્રેષ્ઠ નામ જપાવ્યા ॥ આદ્ય-અંતના સ્વામી તમે છો ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

●●●

ॐ

पवमानः पुनातु मा, क्रत्वे दक्षाय जीवसे ।
अथो अरिष्टातातये ॥२॥
उभाम्यां देव सवितः पवित्रेण सवेन च ।
अस्मान्पुनीहि चक्षसे ॥३॥

अथर्व वेद : कांड-६, सूक्त-१९, मंत्र- २, ३.

॥ ગત્‌ગંગા પર છાંટ નાખી નમસ્કાર કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! તમે આદ્ય નિરંજન નિરાકાર ।। નિષ્કલંકી નારાયણ રૂપે ।। ત્રણ મૂરતનાં એક રૂપ ।। આદ્ય પુરુષથી ૐ કાર ।। તમે સૃષ્ટિના સર્જનહાર ।। છેદી ઇંડ રચ્યો સંસાર ।। ત્રણ મૂરતનો એક વિચાર ।। સાતે સાગર એકાકાર ।। ખગોળ ભૂગોળ માંહે સચરાચર ।।

સ્વર્ગ ।। મૃત્યુ ।। પાતાળ ।। જળ ।। સ્થળ ।। પર્વત ને સમુદ્ર સાત ।। જમીન ।। સ્થાવર ।। જંગમ ।। ગામ ।। સીમ ।। વૈભવ ।। નગરે ।। નવખંડે ।। ચોર્યાસી મુલકે ।। એકવીસ બ્રહ્માંડે ।। માયા વસુંધરા ।। તમે રચી ।। આસન ।। સિંહાસન ।। ઘટ પાટે ।। એક મૂરત ત્રણ દેવ મળી ।। કળશ માંહે કળા ધરી ।। સ્વામી તમે અમી નૂરની છાંટ નાખો ।। તમારા જીવોને તમારી શરણમાં રાખો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

ता अपः शिवा अपोऽयक्ष्मंकरणीरपः ।
यथैव तृप्यते मयस्तास्त आ दत्त भेषजीः ।।५।।

अथर्व वेद : कांड-१९, सूक्त-२, मंत्र-५.

।। ઋષિવરને મુખે (ચહેરા પર) છાંટ નાખીને ચરણામૃત પીવાનો મંત્ર ।।

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

અથર્વવેદી કાયમ પાયા ।। અજંપા જાપથી અમર કાયા ।। આદ્ય અંતે દર્શન આપો ।। ધર્મ સલામત રાખો ।। વિશ્વાસ અખંડ રાખો ।। સત્ય સબૂરી આપો ।। કરોડ કરોડ અપરાધ કાપો ।। ખોળે તે છૂટે ।। ડરે તે તરે ।। નૂર નિષ્કલંકી નારાયણનું જે ઋષિવર પીએ ।। તે જીવ અનંત કરોડીની સોબતમાં મળે ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

• • •



ॐ

शं नः आपो धन्वन्या ३ः शमु सन्त्वनूप्याः ।
शं नं खनित्रिमा आपः शमु याः कुम्भ आभृताः शिवाः नः सन्तु वार्षिकीः ॥४॥

अथर्व वेद : कांड-१, सूक्त-६, मंत्र-४.

॥ મુખી મહારાજને ચરણામૃત પીવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

તમે દેવ નિરંજન નિરાકાર ॥ તે નિષ્કલંકી નારાયણ દશમો અવતાર ॥ હે ઈશ્વર ! યુગો યુગના

બ્રહ્માજી ॥ તમે નૂર પાવળની છાંટથી ॥ સપ્ત પાતાળ, એકવીસ બ્રહ્માંડના બાંધ્યા બંધ ॥ તે નૂર પાવળેથી બાંધ્યા બંધ ॥ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર ॥ કળશમાં કળા ધરી બેઠા ॥ તે નૂર છાંટના બાંધ્યા ॥

સ્વામી ! તમે હરિ અંશના હંસ રાજા ॥ પરિદેવના ટોળ ॥ ૐ કારે વસે સ્વામીજી ॥ પાતાળે દેવતા ॥ જમીન, આસમાન, પવન, પાણી, ગુપ્તી, પ્રગટી ॥ કુળ માંહે ॥ ગોત્ર માંહે ॥ આણી વેળાએ ॥ જે કોઈ નૂરની વાસના કરે ॥ તે જીવની આશ પૂરો ॥ આદ્ય બ્રહ્માએ ઘટપાટ સ્થાપ્યા ॥ ચારે દિશાએ ફેરવી આશિષ ॥ અનંત રૂપે ચરિત્ર કીધાં ॥ કર્તા મૂરત સોઈ ॥

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●

ॐ

यद्देवा देवान्हविषायजन्तामर्त्यान्मनसामर्त्येन ।
मदेम तत्र परमे व्योऽमन्पश्येम तदुदितौ सूर्यस्य ॥३॥

अथर्व वेद : कांड-७, सूक्त-५, मंत्र-३.

॥ કળશ વિસ્થાપન કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ૐ કાર ॥ ૐ નમો શ્રી નિષ્કલંકી નારાયણ ॥ મન હેતે બાંધ્યા જળ કુંભે રહે ॥ જળે બાંધ્યા કુંભ છે ॥ કુંભે બાંધ્યા જળ રહે ॥ અને જળ વિના કુંભ ન હોય ॥ જ્ઞાને બાંધ્યા મન જોએ ॥ ગુરુ વિના જ્ઞાન ન હોય ॥ આદ્ય કુંભ કળશની ઘડી ॥

ઉત્પત્ત જળ વડે ભરી ।। તે આદ્ય કુંભ સદા ઉત્તમ ઉપન્યા ।। તે કુંભની પૂજા પરિવર્તતે હો સ્વામી ।। તે સદ્‌ગોર દર્શન બુજંતે હો સ્વામી ।। તે જીવો કારણે ભયે ગોર બ્રહ્મા ।। ૐ કારે આદ્ય ઉનાદે હરિ ।। તે મહા બલવંત દેવતા ।। આજ કલિયુગમાં હરિ અલખ નિરંજન અવતાર પાત્ર ।। તે નર ઉત્તમ ઉપન્યા હો સ્વામી ।। જે માનંતે ।। જે પૂજંતે ।। તે લહેતવમ્ ।। મહેર મહેલમ્ ।। અમર ભોજનમ્ ।। અમરાપુર વાસમ્ ।। જે ના માનંતે ।। ના પૂજંતે ।। તે જીવ જાવંતે ઘોર અંધારે ।। તે જીવ ભવોભવ બુડંતે હો સ્વામી ।। એ છે સદ્‌ગુરુની વાચા ।।

પહેલા કર્તાયુગમાં ચાર સ્વરૂપ ।। શ્રી મત્સ્ય ।। શ્રી કૂર્મ ।। શ્રી વરાહ ।। શ્રી નૃસિંહ ।। બીજા ત્રેતાયુગમાં ત્રણ સ્વરૂપ ।। શ્રી વામન ।। શ્રી પરશુરામ ।। શ્રી રામ ।। ત્રીજા દ્વાપર યુગમાં બે સ્વરૂપ ।। શ્રી કૃષ્ણ ।। શ્રી બુદ્ધ ।। આજ કલિયુગમાં એક સ્વરૂપ શ્રી નિષ્કલંકી નારાયણ ।। ઘટ-પાટ સ્થાપી ।। ઋષિ ઉદ્ધાર્યા ।। દૈત્ય ચાંપ્યા પાતાળ ।।

એણી પાવળે સીધ્યા રાય પ્રહલાદ ।। પાંચ કરોડી જીવોનાં તો સર્યાં કાજ ।। એણી પાવળે સીધ્યા રાય હરિશ્ચંદ્ર ।। ગુરુને વચને મૂક્યાં રાજ ।। સાત કરોડી જીવોનાં તો સર્યાં કાજ ।। એણી પાવળે સીધ્યા યુધિષ્ઠિર રાય ।। પાંચ પાંડવે છોડ્યાં રાજ ।। નવ કરોડી જીવોનાં તો સર્યાં કાજ ।। એણી પાવળે સીધ્યા સદ્‌ગુરુ ।। કાગળનાં કીધાં જહાજ ।। બાર કરોડીનાં તો સર્યાં કાજ ।। નીમે જળ ।। નીમે સ્થળ ।। નીમે બાંધી પાળ ।। સદ્‌ગોર બેઠા જાંબુદ્વીપે ।। કુંવારીકા ક્ષેત્રે ।। ઘટ-પાટ પખાળ્યા ।। ઘટ-પાટ સ્થાપી ।। ઋષિ ઉદ્ધાર્યા ।। દૈત્ય ચાંપ્યા પાતાળ ।। સ્વામી ! સાચા તમને નમસ્કાર ।। યેહી પાવળકા યહી વિચાર ।। સદ્‌ગોર કથંતે ।। શ્રી સ્વામીજીની વાચા ।। ગગન મંડળમાં અમીરસ હોય ।। ત્યાં નિરંજનકા વાસા ।। સુગરા હોય સો ભરભર પીએ ।। નુગરા જાય પ્યાસા ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

तस्मादमुं निर्मजामोऽमुमामुष्यायणममुष्योः पुत्रमसौ यः ॥२॥

स ग्राह्याः पाशान्मा मोचि ॥३॥

तस्येदं वर्चस्तेजः प्राणमायुर्नि वेष्टयामीदमेनमधराञ्चं पादयामि ॥४॥

अथर्व वेद : कांड-१६, सूक्त-८, मंत्र-२,३,४.

॥ પાટ વિસર્જન કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! સાચા તમે ।। પવિત્ર તમે ।। આદ્ય તમે ।। અંત તમે ।। પ્રગટ તમે ।। ગુપ્ત તમે ।। દાતાર તમે ।। ઈશ્વર તમે ।। કાયમ તમે ।। કિરતાર તમે ।। માલિક તમે ।। દયામય તમે ।। તમે કરો તે થાય ।। તમારે મંદિરે-દ્વારે જે કોઈ આવે ।। સકળ સંઘને ભાવે ।। અમારા અપરાધ ક્ષમા કરો ।। બીજા અપરાધ ના કરાવશો ।। પાંચ, સાત, નવ, બાર, તેત્રીસ કરોડીના મેળા આપો ।। લાખ ચોર્યાસીના ફેરા ટાળો ।। સકળ સંઘને દર્શન આપો ।। સેવક ક્ષુધાર્થી, પેટાર્થી ।। અમારા સર્વ અપરાધ ક્ષમા કરો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

ॐ

इममोदनं नि दधे ब्राह्मणेषु, विष्टारिणं लोकजितं स्वर्गम् ।
स मे मा क्षेष्ट स्वधया पिन्वमानो ।
विश्वरूपा धेनुः कामदुधा मे अस्तु ॥८॥

अथर्व वेद : कांड-४, सूक्त-३४, मंत्र-८.

॥ ભોજન તથા પ્રસાદ જમવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! તમે સૃષ્ટિના સર્જનહાર ।। થાળ મહેમાની ।। તમારે ભાવે સુભાવે ।। તમારે નિમિત્તે ।। તમારે ભોજન સ્થળે ।। કબૂલ કરો ।। અન્ન પાણીના આહાર ।। પાન ફૂલના ભોક્તા ।। સકળ સંઘ ઉપર દયાની દૃષ્ટિ કરો ।। તમારું તેજ પ્રગટ કરો ।। સેવક પર દયાની દૃષ્ટિ કરો ।।

અનંત જીવ તપ કરી આવ્યા ।। એમ દેવ વેદ વાયક ભાખંતે ।। સદ્‌ગોરે હેત કર્યા ।। તે ચતુર વેદી બ્રહ્મા ।। સ્વામી ! હક સચ્ચાઈના દાણા ।। સેવાએ આણ્યા ।। જયાંના દાણા ।। ત્યાંથી હક ઉદ્યમ કરીને કમાયા ।। સત્યસું લાવ્યા ।। પ્રેમસું પકાવ્યા ।। સંન્યાસી ગ્રાસ દાણા ।। બ્રહ્માર્પણ કરીને જમ્યા ।। સ્વામી તમોને પહુંચાયા ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

धाता विश्वा वार्या दधातु प्रजाकामाय दाशुषे दुरोणे ॥

तस्मै देवाः अमृतं सं व्ययन्तु विश्वे दवो अदितिः सजोषा ॥३॥

अथर्व वेद : कांड-७, सूक्त-१७, मंत्र-३.

॥ ભોજન તથા પ્રસાદ જમ્યા બાદ બોલવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે....

એક ઘણું દાન ॥ સહસ્ત્ર ઘણું પુણ્ય ॥ દેહસ્ત્ર દુનિયા ॥ સહસ્ત્ર આખરત ॥ હર હંમેશ સેવકની રક્ષા

કરો ।। વિશ્વાસ અખંડ રાખો ।। ધર્મના માર્ગે રાખો ।। સ્વામી ! સહાય કરો ।। જે ભંડારથી પ્રસાદ આવે ।। તે ભંડાર ભરપૂર કરો ।। સ્વામી ! તમારો પ્રસાદ ।। તમે આપ્યો ।। સેવક જમ્યો ।। પ્રકાશ થયો ।। સ્વામી ! તમોને પહોંચાયો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●



ॐ

पूषेमा आशा अनु वेद सर्वाः सो अस्माँ अभयतमेन नेषत् ।

स्वस्तिदा आधृणिः सर्ववीरोऽप्रयुच्छन पुर एतु प्रजानन ॥२॥

अथर्व वेद : कांड-७,सूक्त-९ मंत्र-२.

॥ વારિયજ્ઞ-મહાપૂજા સમાપ્તિ બાદ ગત્‌ગંગા વિસર્જનનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

સ્વામી ! તમે વાટે ઘાટે મુશ્કેલ આસાન કરો ॥ વિઘ્ન દૂર કરો ॥ શયતાન તોફાન દૂર કરો ॥

વાડી તમારી હરીભરી રાખો ।। કમાણીમાં લાભ આપો ।। જગત-વ્યવહારમાં લજ્જા આબરૂ રાખો ।। તમારે નીમે-ધર્મે ।। તમારી દશાંશ સુક્રીતે ।। તમારી ક્રિયા આચારે ।। તમારી ગત્ ગંગા ઉપર મહેરબાની રાખો ।।

જાંબુદ્વીપના ધણી ।। તમે ઉપન્યા ઊંચ સ્થાન ।। સહસ્ત્ર દ્વીપને ભરતખંડે કીધાં મુકામ ।। જેણે ગુર્જર ખંડમાં કીધાં ઠામ ।। જે આવી વસ્યા ગીરમઠા ગામ ।। તેનું પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ નામ ।। જે કરશે અનંત કરોડી જીવોનાં કામ ।। તે આદ્ય વિષ્ણુ નિરંજન નારાયણ ।। તમે સેવકની મુશ્કેલ આસાન કરો ।। લક્ષ ચોર્યાસીના ફેરા ટાળો ।। તેત્રીસ કરોડીના મેળા આપો ।।

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

● ● ●

ॐ

अभि त्यं देवं सवितारमोण्योऽः कविक्रतुम् ।

अर्चामि सत्यसवं रत्नधामभि प्रियं मतिम् ॥१॥

अथर्व वेद : कांड-७, सूक्त-१४, मंत्र-१.

॥ ઊગતા સૂર્ય નારાયણને નમસ્કાર કરવાનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

ઊગતા સૂરજ ॥ આથમતા ભાણ ॥ નર બીજ તે શ્રી નિષ્કલંકી નારાયણ નામ ॥ તમે સત્યના

પ્રેરક-ધારક રક્ષણહાર ॥ પઠંતે ગોર ગાયંત્રી ॥ જપે તપે બિંબ ઉપાયા ॥ ત્યારે હે સૂર્ય દેવતા ! તમારા શરણે અમે આયા ॥ સ્વામી ! તમે નિરંજન નિરાકાર ॥ ધર્મ કારણે લીધા અવતાર ॥ એટલી પ્રાર્થના નિત્ય કરે તે સ્વર્ગે જાય ॥

સદ્ગુરુ ઈમામશાહ મહારાજ

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ॥

● ● ●

ॐ

दिक्षु चन्द्राय समनमन्त्स आन्धौंत् ।
यथा दिक्षु चन्द्राय समनमन्नेवा
मह्यं संनमः सं नमस्तु ॥७॥

अथर्व वेद : कांड-४, सूक्त-३९, मंत्र-७.

॥ સુદ બીજના ચંદ્ર-દર્શનનો મંત્ર ॥

આદેશ = હરિ ૐ

ૐ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ, આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે...

દયા, ક્ષમા, શાંતિના વર દાતાર ।। હું છું અરજ કરનાર સેવક ।। આજ હો ચંદ્રમા ગુરુ ।। તમે સતિયાનાં સત્ રાખજો ।। અમારા કરગર્યા કાને ધરો ।। સમર્યા સહાય કરો ।। કર્યા અપરાધ ક્ષમા કરો ।। બીજા અપરાધ ના કરાવશો ।।

ઝાંખા, મેઘા, કિન્નર ।। તેત્રીસ કરોડી દેવોના મેળા આપો ।। અનંત કરોડી દેવોની સોબતમાં રાખો ।। લખ ચોર્યાસીના ફેરા ટાળો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

।। ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ ।।

●●●

॥ શ્રી નારાયણ સ્તુતિ ॥

नारायणं निराकारं नरवीरं नरोत्तम् ।
नृसिंहं नागनाथं च तं वंदे नरकांतकम् ॥

નિરાકાર, શૂરવીર, નરોત્તમ, નૃસિંહ ભગવાન, કાલીયનાગને નાથનાર અને નરકનો અંત લાવનાર એવા નારાયણ પ્રભુને હું નમસ્કાર કરું છું.

●●●

॥ શ્રી વિષ્ણુ સ્તુતિ ॥

શાન્તાકારં ભુજગં શયનં, પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગન સદૃશ્યં, મેઘવર્ણમ્ શુભાંગમ્ ॥
લક્ષ્મીકાન્તં કમલનયનં, યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વંદે વિષ્ણું ભવભયહરં, સર્વ લોકૈક નાથમ્ ॥

●●●



સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ



આદ્ય જગદ્ગુરુ સત્પંથાચાર્ય
શ્રી કરસનદાસજી મહારાજ



પ.પૂ. બ્રહ્મલીન જગદ્ગુરૂ સત્પંથાચાર્ય
શ્રી નાનકદાસજી મહારાજ



પ.પૂ. જગદ્ગુરૂ સત્પંથાચાર્ય
શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ

॥ सनातन सत्पंथ ॥
प्रेरणापीठ-पीराणा

યાત્રાધામ, પ્રેરણાપીઠ-પીરાણા,
તા. દસક્રોઇ, જિ. અમદાવાદ

